

સ્વ. માનસંગળ બારદ કુમારક ટ્રેસ્ટ - સંચાલિત

વર્ષ ૩૦ મુનિ

અંશ ૧૨ મે

સ. ૨૦૪૭

સન ૧૯૬૭

સરોવરાય

તંત્રી-મંડળ :

પ્રા. કૃ. કા. શાસ્ત્રી

ડા. ના. કૃ. ભટ્ટી

ડા. સૌ. ભારતી અહેન

શેલત

માનસ

[ઇતિહાસ-પુરાતનવિનું એક માત્ર ગુજરાતી માસિક]

આધ તંત્રી : સ્વ. માનસંગળ બારદ

ઇતિહાસ-દેખાકની સાવધાની

“ભારતીય ઇતિહાસનો અભ્યાસ કરનારાએ વૈજ્ઞાનિક સંશોધનની અર્થાંચીન પદ્ધતિનું અનુસરણ કરવું જોઈયે. આપણા હેતુ સત્ય સંશોધનનો— એક માત્ર સત્ય સંશોધનનો હોવો જોઈયે અને ધ્યેય સિદ્ધ કરવાને માટે ધ્યાય જ પ્રાપ્ત પુરાવાએ તરફ આપણાં ચયનને નિર્ભિયતાપૂર્વક અને હોઈ પણ જાતના પૂર્વાંગ કે પૂર્વ નિશ્ચય વિના જોઈ હોય જોઈયે. વડીલને બદલે ન્યાયાધીશના જીવસાથી એ સાધનાનો ઉપયોગ કરવો જોઈયે અને એ સાધનો જોટલું કરવાની આજા આપે તેથે સુધી જ આપણા નિર્ભિયને આકાર આપવો જોઈયે. આપણને અનેક કિસ્સાઓમાં સ્પષ્ટ પરિણામો ન ભણે અને આત્મ તેમ નિર્ભિયતાક પરિણામો થાડાં અને નાણ ન હોય તેવાં પણ હોય, પરંતુ મામૂલી અને આપુરતા પૃથ્વીમિકાએ બાંધેલા અર્થમાયને સિદ્ધ તરીકે રજૂ કરવા કરતાં આજીવાન જાહેર કરવું, શાંકાઓ વ્યક્ત કરવી અને વિશ્વાસક શક્યતાએ રજૂ કરવી એ બધું સારું છે.”

— ડા. અનંત. સી. મળુમદાર

[૬ હિસ્ટરી ઓનડ કસ્ટર ઓફ ધી ઇન્ડિયન પીપલ : વેદિક એચ્જ, પુ. ૪૦ નો અનુવાદ]

With Best Compliments From

**VXL INDIA (LTD.)
(SAURASHTRA CHEMICALS)**

PORBANDER

MANUFACTURERS OF BASIC CHEMICALS

SODA ASH LIGHT : Used by Housewives/Dhcbis and other weaker sections of the Society as also by Industries like Detergents, Silicate, Soap, Textiles, Aluminium, Dyes etc.

SODA ASH DENSE : Used by Ultramarine Blue, Bichromate and Glass Industries.

SODA BICARB : Used for tanning, printing, jaggery etc

CAUSTIC SODA (LYE) : Used in manufacture of Wood pulp, Soap, Chemical Intermediates, Dyes, Cosmetics, Bleaching, Dyeing & Printing, textiles, Petroleum Refining, Aluminium Manufacture, Oil Extraction, Paint and Varnish, Mercerizing cotton.

TELEPHONES : 21735, 36 & 37

TELEGRAM : SAUKEM

TELEX : 0166-201

FAX : 0286-21431

ALWAYS BUY THE BEST AND THE FIRST 'THREE LIONS BRAND' PRODUCTS.

सामार - स्वीकार

भारा (पिना - संपा). श्री पुष्पोतम गणेश मावलांकर, प्र. संनिधि प्रहारान वती श्रीमती पूर्णिमा पुष्पोतम मावलांकर, 'जीपिटा', भावाराष्ट्र सोसायटी, एविसचिज्ज, अमदाबाद-३८०००६; डेमी सिंगल ८ पेट. पृ. १५+४४; २७-२-१९८६; फि. ३. १५०/-

स्वनामधन्य विटेह मान, दादासाहेब गणेश वासुदेव मावलांकरनी ४०-मरतापाठी प्रहारान-४ तरीके असिंह येदेसे आ अथ एक नवी ४० भात पाडानारो. छे. लाई श्री पुष्पोतमभाईना आ शांदो ऐनुँ शहस्य सं४०८ एरे छे 'पाच वर्ष' पेक्खानी वात छे. गांधी निवार्णु दिन (३० जूनसुआरी, १९८८ ने रोज), भनमां एक भजी थई. पूर्ण दादासाहेबी ४०-मरतापाठी (२७ नवेम्बर, १९८८ थी २७ नवेम्बर १९८९) प्रक्षेत्रे येमने लगतुँ अने अमेलु लपितुँ अहुविध साहित्य प्रगत हरवानी साचे एक विशेष ग्रन्थ गुजराती-लापी आपशी प्रल समक्ष साहर करवो! पिताने अद्विक्षिण अर्पण ने निभिते. आपणा प्रदेशमांना येवा ४० पिनुरुद्य वीज महातुलावेने पथ आदर्शक्षिणि तेम अपौण न होवी? अने पचासो घ्नेही ज्ञेने पत्रो पाठ०४० ने ते ते महातुलावेने पेतपेताना पित ज्ञाना स क्षिप्त ऊपर्युक्ति भाट प्रार्थना हरवामां आवी. अथनी अनुभविष्णु नेतों पदेली नजरे ये लेवा अगे छे ३ विलाग-४०८ ना ४५ था ५० अे ७ देशीमां १ दो. सरु फुटूँ आ गलनत फूलु भावलांकर विशेसो. येमना पुन श्री देशवतो देव भाद हरतां ४५ मो लाई भालाउखुनो, ४७ मो लाई नगरिनो. अने ४८-५० अे वलु लाई पुष्पोतमना. छे. आने लाई डै. विष्णु नथी असी अमी लेवा अगे छे. डेवा भुव्यां-दिवाना अने प्रकावणां स्वलावना विष्णुलाई हता! यरे आद्येतामांना मोटा वलु आद्येतानो अमारा संघ अे आद्येतानी जिलदिलिनो. डेवो सुक्षम छे अे मात्र हंडयां छे, ऐनुँ असूरेतां दृश्यं अस्त्रावित छे

"वेमाग-न्यामा ३८ देशी छे तेमां स्व अंडुकाई ४. देसाईने विशे ए सोनोना अने स्व नरहरि ४. परीभ विशे ए सतोनोना छे, ए शीते ३७ महातुलावेना चरित मुक्तब थयां छे 'विभाग-न्याम' चार महातुलावेनां अने 'विभाग-न्याम' एक अम ४२ महातुलावेना वाशनो ए अपेसो परिचय वांचवा अगे छे. पेतपेताना केवर्मां आ यथा महातुलावेना चोक्स प्रहारतुँ महात्व धरावनारा छे आमां हाक्साहेब फासेहकर, प्रा. हिरोज हावशळ दावर, हानउआई नानाकाई देसाई, अंडुकाई देसाई महादेवलाई देसाई, रमभुवास व हेपाई 'द्युमेंगु', डेव व ल्यू द अव, रमभुवाई भ. नील४८, नरहरि परीभ, लीक्सास पारीभ नानाकाई ४. अट, अगरविहारी अडेता, डॉ. ज्वराज अडेता, नर्मदायांकर दे अडेता, नानाक ४. अडेता, डॉ. सुमंत मडेता, ४. मा. सुनथी, मेहेणी, कस्तुरलाई शेठ, अमृतलास शेठ, अ'भालाल सारालाई, 'मुद्री', रसिलास परीभ म गणाहास पारीभ, दृढव ल्यू व अजिंठ (येमना पालित पुन नेवा धनवांत अजागो) आ भगातुलावेनो गुजरातना उत्थानां एक अने छाई प्रहारानो. श्वेता रहेसी छे. सातानोने दृश्य लभयेस होई आमां येने प्राथमिक भाडितोने स्पष्ट रखुडा आपे छे जुदा जुदा झेत्रना यहडा अने पथ नेमने पेताना भागैदर्थै भानी रखा छे तेवा आ ४२+२ = ४४ महातुलावेना मेणवणां धन-यलांय गुजरात-सीराष्ट्रे भल्यु छे येमां चरितोनी वायडानी विचारधारामां विभिन्न प्रहारना आद्येतांचिन अदां थाय छे. आमां अत्युक्तिनो स्वर्पं नथी अ चरितकेअहतुँ ४८-पासुँ छे. लाई पुष्पोतमभाईने अनेसो. आ विचार ध-यवाहने पात्र छे.

आरा एक्यी वधु अथा एक्यी वधु स्थेसे संवित थई आवे तो गुजरातना सामाजिक इतिहासां पथ येक्षण प्रहारतुँ सत्य येवा निःपृथुष्य पुष्टिदावह अने अवो अमारो भत छे. लाई श्री पुष्पोतमभाईने अमारा शतशः ध-यवाह.

— न. श्री

નિષ્ઠ

‘પથિક’ પત્રેક અ ગેજી ગર્હાં
તાની ૧૫ મી તારીખે પ્રચિન્દ થાય
છે. પછીના ૧૫ હિન્દુસમાં અંક ન-
મળે તો સ્થાનિક પોર્ટ ઓફિસ-
માં વિભિત્ત ફરિયાદ કરવી અને
એની નફલ મને મોકલ્યાની.

૦ ‘પથિક’ સરેરોપોળી વિચાર-
ભાવના અને સાનતું માસિક છે.
જીવનને શર્ધે જાળી અનાપત્તી
અભ્યાસપૂર્ણી અને શિષ્ટ ઔદ્ઘિક
દાખાણે સ્વીકારવાના આવે છે.
૦ પ્રચિન્દ થઈ રહેલી ફૂતિને ફરી
પ્રચિન્દ કરવા માટે ન મોકલવાની
દેખકોણે કાગળ રાખ્યાની.
૦ ફૂતિ સારા અભ્યાસ શાલીઓ અને
જીવનની એક જ બાજુથે લખેલી
હોવી નેટિઓ, ફૂતિઓ ડોઈ અન્ય
ભાષાના અવતરણ મુક્યાં હોય
તો એનો ગુજરાતી પરલ્યુમે
આપવો જરૂરી છે.

૦ ફૂતિમાંના વિચારેનાં
જીવાભાદરી લેખકની રહેશે.
૦ ‘પથિક’ન પ્રચિન્દ થતી ફૂતિ
જોના વિચારો-અભિપ્રાયો સાથે
તાંત્રી સહમાં છે એમ ન સમજતું.
૦ અસ્વીકૃત ફૂતિ પાછી મેળવ-
વા જરૂરી ટિકિટો આવી હો
તો તરત પરન કરાશે.
૦ નમૂતાના અંકની નફલ માટે
૩-૫૦ ની ટિકિટો મોકલ્યાની.
મ.એને ઝડપી પત્રો લેખ્યા
પથિક કાર્યાલય, મધુરા, અનિસ-
ાંજ, અમદાવાદ-૩૮૦૦૦૬

આદ્ય તાંત્રી : સ્વ. માનસ-ગણ માર્ગ
તાંત્રી-માંદળી () વાર્ષિક લખાજમ : દેશમાં રૂ. ૩૦૦/-
ગ્રા.કે. કા. શાસ્કો () વિદેશમાં રૂ. ૧૧૧/-, ફૂટિક રૂ. ૪/-
૨૦ ટો. નાગાલુલાઈ લાટી, રૂ. ૩૦. લારતીબાંદેન શેલત

વર્ષ ૩૦] ભાદ., સ. ૨૦૪૭ : સાર્ટે., સને ૧૯૬૭ [અંક ૧૨

અનુષ્ઠાન

સામાર સ્વીકાર	તાંત્રી	મુખ્યપદ
૩૦ આ વર્ષનું તે	તાંત્રી	૨
કુનીતવાસી ભારતીયની આપનીતિ	છાટેવાલ મિસન્સી	૩
કાલાવડ પંથકનાં સ્થાનો	શ્રી. યશવંત ઉપાધ્યાય	૪
બૌદ્ધકાલીન ખીઅનોના સમાજિક	ડૉ. નિર્બજના વોરા	૫
દરજને		
સુરતમાં નવાયોતું આસન	ડૉ. મુગટલાસ પો. ભાવીસી	૬
સૌંઘ્રમી ગાયકવાડી સત્તા	શ્રી. ધિરુલાઈ પુરોહિત	૧૪
સૌરાષ્ટ્રમાં વનસ્પતિ-આધારિત	શ્રી. હસમુખભાઈ રાસ	૨૧
ગામ-નાગે		
અગ્રી નગરીના ફૂરી નેતા	પ્રે. જિતેંદ્ર નાનાદાલ	
	અંતાણુ	૨૭

વિનાંતિ

વાર્ષિક માલકોણે પોતાનું ડેપોની સર્વા કોલેજ યા
શાળાનું લખાજમ રૂ. ૩૦/- હજુ ન મોકલ્યું હોય તો સલ્વર
મ.એ.થી મોકલી આપવા હાર્દિક વિનાંતિ. સરનામામાં જોળ
વર્તુલમાં પહેલો અંક ક્યા માલારી આહુક થયાનું કરું
છે. એ માસ પહેલાં લખાજમ મળ્યું અધીષ્ટ છે.
અગાઉના લખાજમ એક કે જેકીથી વહુ વરેનીં આપુ છે તેએ પણ
સવેણ મોકલી આપવા રૂપા કરે. અંક હાથમાં આવે એ આગામાં
લખાજમ મોકલી આપાનરે આવા વર્તુલને ધ્યાનમાં ન વેચા નિનાં
‘પથિક’ના આશ્રમદાતા રૂ. ૧૦૦/-થી અને આજીવન સંહાય
રૂ. ૩૦૧/-થી થવાય છે. બેટ તરીકે પણ રક્ખો સ્વીકારવામાં
આવે છે. સ્વ. શ્રી. માનસ-ગણ ઈન્સ્ટિન્યુટ અને ‘પથિક’ના માલકોણે
‘પથિક કાર્યાલય’ના નામના મ.એને ઝડપથી મોકલી આપવા નિનાં.
આ છેલ્લી એ પ્રકારસી તેમ રૂ. ૫૦ થી લઈ આવી વહુ બેટના
જ રહે છે અને એનું માત્ર રૂપાજ પરાય છે રૂ. ૧૨-

૩૦ મા વર્ષાંતે

૧૯૮૪ના ફેલું, થા સુ. માનસંગળના અમો ભિનોએ ‘પથિક’નું પ્રકાશન લાય છુટું’ તથા એના પ્રકાશનનું રૂટ મું વર્ષ ચાલતું હતું. જેનો આરાબ ૧૯૮૩ ના ઓદ્ડોઅર્થી થયો હતો. ૧૯૮૭ નો ઓદ્ડોઅર આવી રહ્યો છે કે જ્યારે ‘પથિક’નું ૩૧ મું વર્ષ ચાલ થયે. [વાચકોની અહીં ક્ષમા માગવાની છે કે ‘પથિક’ના ચાલુ વર્ષના અડોઝાં તો અંદરના જ લા પૃથ્ર ડિપર વર્ષ ૩ મું અરોપર છપાયું છે, પરિદ્ધ મુખ્યપૂષ્ટો અન્ય આપણાનામાં છ્યાતાં હોઈ ચાલુ વર્ષના જાન્યુના અડોઝાં મુખ્યપૂષ્ટ ઉપર ૩૦ મું છાપાયું જોઈયે, કારણ કે એ ૩૦ મા વર્ષનો ૪ થો. અંડ હતો, પણ ઈસ્ટરનું વર્ષ જાન્યુથી મહાયાત્માં ભાપણાનાં સરતચૂંઠી વર્ષ ૩૧ મું ક્રી નાખ્યું અને ભૂત છેક ઓગસ્ટ સુધી ચાલુ રહી છે. આ સપ્ટેમ્બરના અંડ પર પાછું વર્ષ ૩૦ મું આવેશ. માર્સિકની ફાઈલ અધારનારે આ વર્ષનું ઘ્યાલમાં રાખવા વિનાંતિ.] સુ. માનસંગળના અવસાન પછી જેમની આવનાને યથાવત સાચાની રાખવાનો અમરો પ્રયત્ન રહ્યો છે. દ્રસ્તીમંડળે થોડા નિર્ધય અદદ્યો છે અને એ દીપોત્સવાંઃ તિલાયતાના ચાલુ અડોઝાં ઉત્તિહાસ-પુરાતન-સંસ્કૃતાના સંસ્કૃતમૂલ્યક લેખો છાપાયા. આને કારણે દક્ષી વાતાઓ, કન્યાચિત્ર સાહિત્યને લગતા વિવેચનલેખા અને ડાઈ હોઈ અન્ય વિષયોના લેખો છ્યાતા હતો તે છ્યાતા નથી, આવું સાહિત્ય છાપણારો ગુજરાત રાજ્યમાં અનેક સામયિકી છે, જ્યારે કંશાધારમૂલ્યક લેખો છાપણાર માર્સિક ખાસ અન્ય ડાઈ નથી. ગુજરાત ઉત્તિહાસ પરિપદ અને સૌરાષ્ટ્ર-કંદ્ય ઉત્તિહાસ પરિપદાંના અધિવેશનો અને ગુનસત્રોાં ગણ્ય ડેટિના સંશોધન-મૂલ્યક નિયંત્રો આવે છે. આ નિયંત્રો છાપણાર સામયિકી આપણી પાસે નથી. એ નિયંત્રોની મુલાકાતી કરનારનો હકીકતે અભાવ છે. ‘પથિક’ એ હિંદુઓ સબાન છે અને એ નિયંત્રોનું પ્રકાશન કર્યો જાય છે. આમાં બંને પરિશોદાના મંત્રોનાની અમને હૂંડું છે. અમે નિયંત્રોની નીચે હું પરિપદમાં વંચાવેદો તે તે નિયંત્રો એની નોંધ મૂક્યેછ્યો. આ નિયંત્રો છ્યાપાવાથી એ લાલ છે: ૧. નવા નવાં સંશોધનાનાં ઇણ પ્રણ સમક્ષ રજૂ થાય છે અને તાનમા વૃદ્ધિ કરાવે છે તથા ૨. નિયંત્રોના લેખકોને પોતાના અમની સંકળતાનો અતુભૂત ચાપ છે, જેને કારણે એમનો સંશોધનલેખો આવતા રહે છે અને યથાવકાર એ જ્યા પ્રકાશિત થતા રહે છે.

મેધચારી સતત વધતી રહી છે, એને પહોંચી વજવા અનામત ઇંડ વધે તો બ્યાબની આવક વધે એટે ચાલુ અહીં આજીજન સહાયક અને એને ભીજને પણ જાનવે, આમાં વાર્ષિક આહી અનોને પણ સહાયમાં ઉપરોક્ત કરી શકે.

અન્ય સામયિકી વાર્ષિક લાલબન તેમજ આજીવન સહાયકોની રકમાં વધારો કર્યો જાય છે, પણ દ્રસ્તીમંડળનો નિરધાર છે કે લાલ લાલી કરીયાં, પણ લાલામો નહિ વધારિયે. અમને તિથાસુ છે કે અમારું કામ વધથંબું ચાલુ રહેશે.

વર્ષ દરમાન અનેક સ્વભાવોને લેખો મોકલી, દીપોત્સવી અંડ ભાઈ કાંગો-ચરિતલેખો-લલુવાર્તાઓ-સંશોધન લેખો મોકલી અમને ભીડો નિર્બાજ સાચ-સહકાર આપેલ છે તેમનો આ તંતે આલાર વ્યક્તા કરતો આનંદ અનુભવિયે છ્યે અને આવે. જ સાચ-સહકાર ચાલુ રાખે એવી વિનતિ કર્યે છિયે.

જાહેરભરો લાલી આપવાના પણ ભાઈ શ્રી પોથુલાલી પંચાંશ, ‘ગોડવોક્ટ’ અને ભાઈ શ્રી અવિનાય મંચિવારી મહાદ અમને મળ્યે રહે છે. જોગાન-સુનેદ્યારીપીઠના આચાર્ય શ્રીબનનશામજી નાનારાજની પણ હૂંડું અમને છે. આ ઉપકાર અમને હૂંડું આપે જાય છે. વાર્ષિક આહીં જુનાનાં

अने नवानां लवाज्ञम् शेषित करी भोक्तव्यारा अमारा गेवन्ट लाईचेना पण जेट्या ज आकारी छिये. आ जपां सङ्कायक अणे ‘पर्युषं’नी प्रगतिमां उपडारक के. “२३. भानसंगण आरु स्मारक दूरेट”-ना दृस्तीभंडाने भाटे आ माची भूमि के. आ साथ-सालकार यालु रहे खेली सौने प्रार्थना. तंशी कुणैत्यासी एक भारतीयनी आपवीती

ता. २-८-६१ना वडेली सवारमां ज डुवेतने घडो-वाहने थई चूडेलो. भारा इमनी भादार नीकणी रखो छुं तां तो भार्यामां ईराकी टेंकाना दर्शन याव. अहार नीकणी शक्य ऐस नढेतु. भारा भक्तमां दमाई येयो. भारे भारा भक्तमा रथान पर ज्युं भनमां रखी यसुं. दरोज ईराकी शैन्यो आणे ज जनां हाता, साचे ईराकी लोडा पण आणे हाता हाता. रैनिहा अने लोडा भक्तोमा धूमी तोडेहा करता अने अधुं लूटी जला हाता. आसते आसते भोसां प.स्थी खूटवा लाग्या. भारे तिवार रोटकी भेणवा तो कि. भी. जेट्या स्थाने ज्युं पद्धुं हतु अने ए पण लाखी अरूपां. अमारुं सहस्रीम हतुं के वीजणी अने पाण्यानी लाईनो हज तोती नाभी न हता. सांकेतिकामा आवूं के अभिरिक्त विस्तारनी तो अने लाईनो कापी नाभवामां आवी. जेओ. आन पक्षया तेजोने ईराकी लैट ज्वामां आवा. भीज पहेलांथी ज परिचितोने त्या खुपाई रखा हता. शाक तो शिवी ज अंध थई गयुं हतुं. लावेली रोटकी भाईने यसावी लेवातुं. हुं १८ हिवस आपी रिथतिमां रखो त्यांसुखी तो कुणैत्या भोदा भागनी वीजणी ने पाईप लाईनो कापी नाभवामां आवी हता. अमारी सामे रैनिहा अने ईराकी लोडा भक्तोमा धूमी ज्वाने लेडेनो भादार तिक्कगा मजबूर करता अने बरनी वस्तु भान नहि, भक्तमानां ईवेक्ट्रिक हेवडां ने अद्य पण लूटी जला हता. अरे भारतीय-पांडितानीओ-भांगडा देववासीओ-श्रीवंडावासीओ पेतानी भोडरेमा नीक्या हेभाता तो. रैनिहा अभो वाहनमांथा उत्तरी काढी, वाहनोमा सवार थई हाँडी मूळता हता. सामा थानाने जनथी अतम करवामा आवता हता, हायथमां तांडाधियाण पण खाली लेता हता. एतु पण लेवामां आवूं के ईराकी रैनिहा कुणैत्या लोडोने पक्तोने गारीजोमा लारी ए गारीजोने संजग्यी मूळता हता. भारी पासे भारतीय पासपोर्ट होवाने करवे भने तो. २८-८-६१ना रोज असाथी कुणैत्या वानी अनुदृगता भावी. असुं लाई नेर्डनी सरकद स्ट्रीन्युं ५० ईराकी दीनार हतुं. भवराते भवरा पहेंच्या ने असो. यालु रही अने अभो भवराते अभवाद पहेंच्या. रते ज अभवाद लेइयुं अने तो. २ अनी भवराते लेइनी हठमां पहेंच्या, ज्ञा युतो अने रेडक्सवागाज्याए अमने सभवडो आपी. भारतीय एवेची आतानां त्यांथं दर्शन थां नहेतां. अमारा पासपोर्ट पर अही नेर्डना सिल्का लाग्या. अने भाव-सामानानी दूँडेमां तो. ३-८-६१ नी भवराते अमान पहेंच्या अने त्या तस्य हिवस पण्या रखा. तंकुणेमां आथय हतो. त्या पण झोराक पाण्यी भाटे ‘हयू’ लागती हुती. भोदाकमां रोटी अने फाचं टोटो भाव भजती हतां. ३ ही तारीमे रातनां १२ वार्षे पेन पकडयुं ने उभी सवारे मुंबईना दर्शन थाव. अही उतरता रेवेपे भास अने ३. ४००/- दैरेक युजराती यावीने आपवामा आवता हता अना आधारे अभवावानां दर्शन क्या. अमारा भाव सामान, ऐन्डमा ज्ञा. २४मा अहुं ऑरीने आव्यां. हेवे ज्युं के, पण भारत सरकार ‘विजा’ आपती नवी. भारी बांडगामी क्षागीरीनी त्यां किंभत हुती, अही डॉमुन ओनी कहर लेवामां आवती नवी.

मुंबई उतरता अमारा पासपोर्ट एवरपोर्ट उपर लैट लेवामां आव्या हता ते लभापदी पक्ती पाणा तो भल्या के, पण शा कामना? कुणैत्यी मांग आवे तो ज लैट शक्य.

“पिंडियूरी” तरक्की दिवासो तो आधो के, पण हज तो कहुं इवोक्त थयुं नवी. आकाश सामे जेइने अत्यारे तो यातकी लेम एके छुं.

छोटेलाल विधकमां भिस्ती

पाठ्यक

संघेभारत/१६६१

३

કાલાવડ પંથકનાં સ્થાનો

ધરાવંત ઉપાધ્યાય

કાલાવડ આજુભાજુનાં જૂનાં સ્થાનોમાં કેટલીક જગ્યાએ હીંબાઓ પણ છે, કેના ધૂન ધોરાળ્યો દિક્ષિષામાં એક ડિ. મી. દૂર હીરારીથી.....નામનો હીંબો આવેલ છે. તાં અંડે નેલું મંહિર છે. મધ્યન નેલું લાગે. મંહિર ઉપર ધૂરમણ હોય...આ સ્થાન ધૂનધારાળ્યો કૂળનાથ જતો રસ્તાનાં આવે છે. જાખકારો પાસેથી વિગત મળી હે એક સમેતે ત્યાં જૂનું જામ હતું.

દાદર નામનું ગામ કે જ્યાં જૂની મંહિરો છે. આ ગામનું નામ દાદર નામની વનસ્પતિ ઉપરથી પદ્ધતું છે. આ વનસ્પતિ આ વિનારામાં થાપ છે, કે દાદર નામના ચામનીના રોગ ઉપર વપરાય છે. આવું 'બીજુ' પણ એક દાદર ગામ હોવાથી આ આમને 'નામદાર' તરીકે પણ ઓળખ-વામાં આવે છે.

કાલાવડ પથંડમાં બોડીગામ છે, આજુભાજુની ધાર વર્ષએ ડાઈ માશુની બોડ-ગોડા ડેંતર એવા ભાગમાં આવેલું હોવાથી હોયનું નામ 'બોડી' પડ્યું હોય. માશુની નામ ઉપરથી ડાઈ ભાગમાં નામ પડેલ હોય એવું ઓઝું નેવા મળે છે, પરંતુ પહોંચી પણ નથી નામ બોડીના નામ સાથે સંણાયેલ છે : બોડીધી, વચ્ચીધીઓ અને કેટલીવાંદી.

જે ગામનાં નામ સાથે મોચાતાં હોય એવું નેવા મળે છે, પણ નથી ગામના સાથે મોચાતાં હોય તેમાં આખરાયેલા ને આપણા ને આરી...એક સાથે મોચાય છે. એ અંગેની એક ડિકિન પણ છે.

"આખર-ઘેલા આપણા ને આરી મોદું ગામ."

રિંડ જરે રૈટખા ને વાળું થું કામ?"

નાના ગામમાં ગામનું તોરણ બાંધનારની યાદી જગ્યાએ છે અને વરસો પછી એ વધિતારી માદમાં એ જામનું નામ જેની સાથે નેલી ટેચામાં આવે છે, નેવાં કે મહાં-મેધાર પાણ-મેધાર. કે રસ્તિનાં કાલાવડ શીતળા-૩૬૧૧૧૦

આદ્ધકાને વિનંતિ

(૧) 'પથિક' દર માસની ૧૫ મી તારીખે પ્રસ્તુત થાય છે. ડાઈને પણ સમયસર ન મળે તો તા. ૨૫ મી પછી અમે તરત જલ્દાને તો અમે તરત તે તે અંક મોકલી આપોશું. લાંબા સમય થયા પછી ઉધરાણી આવે તારે અંક વિકિકાં ન હોય તો અમારે આદ્ધકાને નિરાશ કરવા પડે છે જેની ખાસ નેંખ લેવા વિનંતિ.

(૨) એજન્ટોની દારા થયેલા નવા ચાદ્દકાને તે તે એક વર્ષ પૂર્તું 'પથિક' મોકલવામાં આવે છે. એજન્ટોની સુચના છે કે વર્ષ પૂર્ણ થતાં અંક અંધ કરવા, જ્ઞાન અમે એક માસ વહું અંક મોકલ્યે છિયે. લાંબુખીના લવાજમ ન મળે તો અંક મોકલવાનું અંધ કરિયે છિયે, એકથી વહું વર્ષથી ને ચાદ્દકાની ચાલુ હોય છે તેમને તો લવાજમ સમયસર ન આવું હોય તોયે ચાલુ રાખિયે છિયે. તેથી વિનંતિ કે લવાજમ પૂર્ણ થાય કે તરત મોકલી આપવા શુમ દેવો.

(૩) ટ્રસ્ટ રાજ્યકર્ટર થયેલું હોઈ 'પથિક'ના પ્રમાણની સંખેદરના છે તેથી અમારી ડાંબેલો અને શાળાઓને આસ વિનંતી કે આજુનાન સહાયક થઈ થય કે લેણ્યા એ રકમના બયાજમાંથી ફેદેણાને માટે 'પથિક' મોકલાનું રહે. આ હિસાબો ડોંગેનો આજુનાન સહાયક થતી આવે છે એનો અમે આનંદ છે.

(૪) 'પથિક'ના વાચકામાંથી પણ વાર્ષિક આલક તેમજ આજુનાન સહાયક થઈ 'પથિક'ની કદર કરવા ઉત્સાહિત અને એવી અમારી હાર્દિક વિનંતિ છે.

-તાત્રી
પથિક

બૌદ્ધકાળીન સ્ત્રીઓનો સામાજિક દરજાનો

[બૌદ્ધ દર્શાનના પરિપ્રેક્ષયમાં]

ડૉ. નિરંજના વેરા

એક સમયે રાજ પ્રમેનાથું જૈતવનવિદારમાં ભગવાન ખુદ્દો ધર્મોપદેશ સંભળ્ણ રહ્યા હતા ત્યાં રાજમહેલમાથી આવેલા એક દૂતે રાણી મહેલકાળે પુનીને જન્મ આપેલો હોવાના સમાચાર આપ્યા. પુનીજાના સમાચારથી રાજના મુખ પર વિષાધારી વાદળી છ્વાઈ ગઈ. ગૌતમ ખુદ્દ એનો મનોભાવ પામી ગયા અને કથ્યું: 'હે મહારાજ! ટેક્ટેક્ટ વાર કોણે પુરુષ કરતાં પણ સારી તીવડે છે. અને એટે જન્મેલા પુરુષ શરીર થાય છે પુત્રો ખુદ્દીમતી સુશીલ અને વડીલોને માન આપનારી હોય તો એને કેમ હોય એ શકાય? હે રાજ! તું તારી પુત્રીની પ્રેમથી સંભળણ રાખ!'¹

આ દર્શાનની સમલય છે કે ઈ. પૂ. છૃદી સદીને આ સમય એંવો હોનો કે જ્યારે પુત્રીનો જન્મ અશુભ મનોભાવ હોય. ખૃદીએવું જીવન અસરન્દર કું અને કટ્ટાંક અશે તિરસ્કૃત હતું, પરંતુ તથાગત ખુદ્દ ધર્મ અને સાતના દીપક દાર ખોએના જીવનમાં પણ અજાગ્રત્તા પ્રગટાયું અને એને સામાજિક સંમાનની અભિકારિણી અનારો. આધ્યાત્મિક સાધના માટે પણ એની યોગ્યતા સ્ત્રીઓને કિસ્સુંઘરમાં અંગેને સ્થાન આપ્યું હતું, ખી અને પુરુષ પણે સમાજાની ડેણીવાનો જોગો સૌને ઉપહેલા આપતા. ભગવાન ખુદ્દીના કટ્ટાંક વર્તાવાયો અને ઉપરેશ્વરસંગેને આધારે તત્કાળીન સમાજમાં ખીંતું સ્થાન તેમ દરજાનો કર્તૃના હાનાં એનો જ્યાદા આવે છે અને એ સાથે ખૂંઝલવને જીર્ણગાની અનાવવા એમણે રજૂ કરેલા આદરી પણ માનનારી છે.

ગૌતમ ખુદ્દ એક મહાન ધર્મોપદેશક હેઠાની સાથે એક સર્વાધી મહેવેતાનિક પણ હતા. સાંસારિક અને વ્યાવહારિક જીવનનાં અનેક ક્ષેત્રો વિશેની અભિની સમજ ગજન અને તદ્વસ્પર્શી હતી. સામાન્ય ગૃહરસ્થથી આદરભૂતે નાન રૈનિક ક્ષેત્રો વેપારી વૈદ્ય નિયાર્થી વર્જેરેને જીવનને જીડર્ન્ગમાં અનાવવા કેવા આચાર-વિચારનું પાલન કર્યું અની સુધ્યતા સમજ એનખે આપી છે. એક વાર એમણે કિસ્સુંઘરી વિશ્વાભાને લીનાં સાધારણ કર્તાંયો વિશે યોગ્ય આપ્યો હોતો તે આ પ્રમાણે છે: 'ખોએ વરની વડીલોની આદરપૂર્વક સેવા કર્તૃની જોઈએ, એમને મનુષ વેણું કર્તાં જોઈએ, એમના જીઠથી પહેલા જાહેરું જોઈએ અને સૂતા પજી સુતું જોઈએ. વરની વડીલો ઉપરાત પતિ ફેને આદર આપતો હોય તે સાહુભાગોને ઉચિત સંમાન આપ્યું જોઈએ. વરમાં રાખવામાં આવેલાં ક્રપાલ જીન વર્જેરેનો ધ્યેયિત ઉપરોગ કરતાં શીખ્યું જોઈએ. વરનાં સેવકોને જે કામ સેવામાં આગાહું હોય તે એનો સારી રીત કરે છે કે નહિ અનું જોખે નિરીક્ષણું કર્યું જોઈએ અને એમના મેજાનું પણ ઉચિત ધ્યાન રાખ્યું જોઈએ. પતિ ધર્માને અનું અને ધન ક્ષમે તેને સંભળીને રાખવા જોઈએ. એણે ખુલ્લ તથા ધર્મ અને સંધને શરૂએ જઈને ઉપાસિકા અનું જોઈએ. પંચશીલનું પાલન કર્યું જોઈએ અને કંજીસાઈ છોડી છૂટે હાથે હાન કર્યું જોઈએ.²

ઓઝો વિશેનાં આ કર્તાંયો તત્કાળીન સમાજનસ્થામાં ખીને અવસ્થ ગૈરવ અપાવનરી હતી. એમાં ખી પાસે ત્યાગ અને સમર્પણથી અપેક્ષા રાખવામાં આતી છે, પણ એ જ સુસંક્ષિપ્ત કુંદુંઘ-વ્યવસ્થા અને સુધ્યતામાં સમાજનસ્થાના ઘંતરનાં મૂળભૂત તત્ત્વથ્ય હાનાં. ત્યારે ખોએ ધન કામવા જતી ન હતી, પણ વરમાં આવતી અનું અને ધનને વહીવટ એ કુશળતાથી કરતી હતી. વરનાં વડીલો આજાડો આપણનો અને પરિચારકો આટેનાં ને કર્તાંયો અને માટે નજી કરવામાં આવતો છે

પણિક

સપ્ટેમ્બર/૧૯૬૧

૫

ते परथा धरमां ऐनुं स्थान डेट्लुं भडरत्तुं हतुं ऐनो। प्रथाव आवे के, धरना गृष्ण न आवार अने व्यवहारनी ए सूतधारिणी हती,

डुड़भनी जेम सभाय अने राज्यव्यवस्थामां पशु खेतुं स्थान संमतनीय जेमे भाटे गीतम शुक्ष डेट्ला आग्रही हता ऐमो ज्याव अमना शिष्य आनंद सावेता आ बार्तावाप परथा आवे के, पञ्च प्रजनी आदर्श राज्यव्यवस्था विशे डेट्लीक विगतो जाहुया भट्टी अग्रवान शुक्ष आनंदने पूछे के : 'आनंद! रञ्जु दोडा विवाहित के अविवाहित खीमो उपर शुद्ध तो नवा छरता ने ? अग्रे खीमेतुं भान तो जगवे के ने ?'

आनंद ज्याव आपे के : 'हा, खीमेनी त्यां सारी प्रतिष्ठा के.' आम अग्रवान शुक्ष आग्रोप्य अनुसार आदर्श राज्यव्यवस्था भाटे अग्रे खीमेतुं स्थान भोजासर्वुं द्वाव ए अविवाही के.

बोह आग्रोमां तरहलीन सभालमानी संजग्रेया अने अशुद्धुलानां खीमेनी विथि विशेता डेट्लाक उद्देष्यो भेवे के ते पशु खीमेना दरबन्न विशेता लक्षितोने स्पष्ट करे के.

बोह अने जेन आग्रोमां पूर्व वैष्ण चांस्कृतिमां प्रारंभीतुं ज विवाहतुं विविष्ट स्थान हतुं. वरकून्या अग्निनी साक्षीमां पालिअख्यु इरे ए विषि धारिक अने सामिनित्व दर्मिते महरनो दोडा, परंतु बोह युग्मां विवाहिष्यक बान्धनायामो नोपचान परिवर्तन थेत्यु गंता भेवे के.

बोह आग्रोमां विवाह भाटे ए संधदो जेवा रखे के : आवाह तथा विवाह^५ पुन गटे उत्तम दुखमायी शुक्ष नक्षत्रमां कृत्या लक्ष आनंदी ते 'स्वानां' अने कृत्यानी दारा दुग्धानी दिनो भाटे एवं नक्षत्राना आपी अवनी ए 'विवाह' कृत्याने लक्ष आनंदी अथवा आपा आवनी ए 'आवाह-विवाह.' अमां शुक्ष नक्षत्र जेवातुं तथा गार्ति गेव अने सामिनित्व दरबन्नतुं ध्यान रणातुं हतुं तथा ए भाटे अन्य क्षयांधीक्षनों संयोग पशु विवाह तो.

बोह आग्रोमां आ सिवाय क्षयिष्यक विविभानो उ रिवाहेनुं वर्षन भगतुं नया, बोह परिवर्तोभां डेट्लीक कृत्यायो समभूपूर्द्ध लगतो अस्तीकार रक्षित प्रवक्ष्या पशु धारण करता हती, तो सुंदर पुरुनी पिताने भागां लक्षने आवतारने असंतुष्ट रक्षा न लडे ए भाटे प्रवक्ष्या देवा पशु समनवदी पृ.

वैष्ण छाव पठी डुड़भनी पुनरवृत्ता संमानों द्वास थवा धागो देवा भातातुं स्थान सानलयुं हतुं, पशु बोह धर्मना प्रयार पहेलाना सापामां पुनरवृत्ते यासु-सस्तराना कठोर विवाहस्तुमां रहेतुं पश्यु. पति प्रवक्ष्या देवा ईच्छे तो अने भाटे परनामा अमुमो देवादी वरस रहेती नहि. प्रवक्ष्या देवा ईच्छनार पति साथे ए वात पशु की शक्ती तोड़ कृतातुं हुए पशु यज्ञा की शक्ती न हती. पुनरवृत्त प्रवक्ष्या देवा ईच्छे तो आ राजेती अमुमो देवा रक्षा अ प्रक्षरतो अमुमो अने शुद्धिया अहु एओ दुग्धनृसेते भगता आसुमी रजन गर रहु भिसुने दान रक्ष आपी दानी नहि. पति-नी प्रवक्ष्याने शरण्यु धत्तीना अवतारा हुएया गदाव वेसरू ज्ञान, पश्यु अने असरु-प्रेषणाना विता करतो पठी नहि. पति पशु कठोरक प्रवक्ष्या देवा पडेवा परनीमा आउतेका भाटे वव था करतो, अपवाहपे पुनरवृद्ध दारा पशु सासु-प्रसराने याता आपानां दृष्टीं नोपानां छ.

डेट्लीक खीमो विभिन्न निमितोयो अने प्रकारोंथा पत्तीत प्राप्त करती. बोह आग्रोमां वाव परिविष्टि अने स्वभावने आधारे पत्तीना डेट्लाक भेद आपवानो आप्या के. आ विभाजना परीक्षण्युथी खीमेनी सामान्य विथि अने गेमनी स्वलाभगत लालिष्यकायेनो वशु स्पष्ट ज्याव भेवे के. आवा परिविष्टि अने आधारे ५८वीना दस भेद पत्तीनां आपाना दृग, ५ एवं ५ के (१) ए अपाने अरीहेली पठी 'बलशीता' डेट्लानी, (२) पेतानी ईच्छा अनुसार डेव पुरुष संये रहेती खी

‘भौतिकसिद्धि’ एवंती (३) वर्षान्ती केर्त्ति क्षी केर्त्ति पुरुष यजमानों क्रोसण-मुसण आहि ज्ञेयपदवेशा गेणाने नेंनी घरात असी रहेती द्वारा ते ‘भौतिकसिद्धि’ तरीके ज्ञेयाभावी, (४) वर्ष भ्रात फ्रीने रहेतानी क्षीने पटवासिनी क्षेत्रा, (५) द्यावेक क्षी अने पुरुष एक ज उद्धवावर्मी द्याव राखीने विषयीनी क्षेत्र आ हरवतुगल एक अनी रहेते ज्ञेय क्षीते ज्ञेयभीज्ञाने हरत अरबु छरतां हतां, आ रीते प्रत स थेली फनीने ‘ज्ञेयातादिन’ क्षेत्रा दता, (६) ज्ञेयाभावा परथी लाकडाने आरो ज्ञेयाने ज्ञेये पत्ती तरीके पति स्वीकरेती घराने ‘ज्ञेयाभव्यम्भाव’ क्षेत्रावाती, (७) जे असी यासेथी जासी असे पत्ती तरीकेना अने प्रकाराना झाई द्यावानां ते ‘जासी-जासी’ क्षेत्रावाती, (८) असी वे वर्षाना जूरी क्षेत्री द्यावी द्याव ते घरात पुरुष साथे संवाद थर्ता अ अंगी ज्ञेये ‘ज्ञेयाभव्यम्भाव’ क्षेत्रा, (९) ज्ञावरे दैविती युद्धव्य ज्ञितवेश प्रदेशी ज्ञेयानां अपरबु क्षीने द्युर्ध आवता अने ज्ञेये पत्ती तरीके स्वाक्षरता तो अने ‘ज्ञेयहरा’ क्षेत्रा, (१०) ज्ञेयाभव्यम्भाव ज जासी अननार अनी ‘मुदुसिद्धि’ क्षेत्रा.

ज्ञेयाभावी अंगात प्रदृष्टि के स्वाक्षर-अतुसार फलीना सात द्वेष पाठवाभावी आवां छे, इ क्षेवा के वयक्तसमा ज्ञेयोक्तुमा आर्थिसामा भानासमा ज्ञेयोक्तुमा सभ्याउमा तथा दासी अधीक्तू के पत्ती अतिना वध गाडे उत्सुक रहेती ते ‘वयक्तसमा,’ के पत्ती इव्यक्तसम्बन्धी ज्ञेयी क्षेत्री ते ‘ज्ञेयोक्तुमा,’ असी भावा क्षेत्री ज्ञेयी सभ्या के दासीज्ञाने अतिनी शाश्वत देती ते ते ते ते ते ज्ञेयाभावी

इव्यक्तव्य तथा यसी तरीकेना ज्ञेया द्यक्षण अने ज्ञेया व्यक्तित्वाने परियथ आपनार आ हक्कीनो तथा अगवत शुद्ध पासे प्रवक्त्वा धारबु द्यरबु द्यावार युक्ता विश्वाभा अक्षयभावा ज्ञिसगेतभी अंगपावी आहि अनेक अस्तुषीज्ञेयी ज्ञेयाभावाने आधारे समजाय छे के तत्कालीन समाजां (१) पुरीदो जनन अशुद्ध भनातो होतो, (२) गृहकार्य ज ज्ञेयातुं कर्तव्य गच्छातुं, (३) लग्न अहु नानी वाहां सारान्व रीते थर्ता न हो, (४) वरीय वर्ती हीक्की अशुद्धगुहाभावी अनादरने पाव अनावी, (५) अतिनां ज्ञेयी द्यक्षण अो हूर वर्तनेना वेग अनेक ज्ञेयी अनावी, (६) सुंदर पुरी भाटे अनेक गार्ग ज्ञावां अने ज्ञेयु ज्ञेयव्यु भानापिता भाटे युक्तेव अन्तु, (७) कैट्टीक ज्ञेयी शाश्वते अक्षयात्मा क्षेत्री ज्ञेयाभावी द्यक्षणां देवमी वस्त्रो वधु अव्यतित होता, (८) परियारिकामो वेश्याभावी अने अस्तुषीज्ञेया स्वयं क्षेत्रावर्न द्यरती, (९) सामान्य रीते असी अर्थ-उपार्जनन् द्युर्ध द्यरती नदी, (१०) यज्ञिसांगे अने वेश्याभावी द्यक्षणे जुहो द्यो, (११) क्षारेक ज्ञेया द्यत्वंप्रयेषे श्रवन वडी शडीनी अने प्रवक्त्वा पञ्च द्युर्ध शडीनी भानापिता के पावको ज्ञेये माटे नार्गंदर्दिक्क अने सदायक अनावा, (१२) राज्य शी ज्ञेयीकृतानी अ लक्ष्युगानी अध्यम-वर्गानी के गरीब-दृष्टीनी ज्ञेय द्येक वर्गानी अने वर्ष्णनी ज्ञेयो ज्ञावां धारबु द्यरती, (१३) प्रवक्त्वा देवा भानापिता के अनुभवी ज्ञेयी पत्ती, (१४) युद्धपते वृद्धज्ञनना विभवाहो संवर्ती, पति के संतानेना मुतुलो आवत, अति दृशिता, हांपत्य-कृतवेशी सर्वनाथ, मोक्षप्रसिनी आतरिह इव्यक्ता अने गौष वर्ष प्रयेषु आर्थिष, आवां अनेक फरवरोनी ज्ञेयो अवक्त्वा देवा प्रेयती, (१५) दुःखी विगन भनेत्तावाणी ज्ञेयो यथा आधारात्मक रात्रीना दूरा दिव्य अने शाति भेणवती,

‘जीदुगयां शुद्धपानाने पत्तीनी भाट्ट धर्मिक अविकार भानावा लाज्या होता, सामाजिक उप-योगितानी दृष्टिपैक नारीने पुरुषीनी संसक्षण भनातो आरंभ थेये दोता, जे चेते वर्ती संचालिका, संस्तिनी भरंजिका अने पति-पुत्रानी संवर्ती भिन्न द्यती, उ

पथिक

सप्टेम्बर/१९६६१

७

ભગવાન શુદ્ધ પતી પતેનાં પતિનાં હર્તાન્યો પણ વર્ષાન્યાં છે, જેવાં કે પતીનું અપમાન ન હો, એને સંમાનથી રાખે, પોતે અન્ય લોકી સાથે વિભિન્ન ન હો તથા લોકોને અંધરા અને અદા-કારના પ્રદાનથી સંતુષ્ટ રહે.

મહાપ્રલિપિ જોતમી જ ગારે ભગવાન શુદ્ધ પાસે પ્રવજના બારશ કરે। આવી તારે એમણે એ લોકાન્યાં એને સંભાળનું સ્થાન આપવાની અનિર્યત હર્તાની હતી, પરંતુ શિષ્ય આવાની પ્રતિનિધિ લોકોને લિઙ્ગશુદ્ધિદા આપવાનું સ્વાક્ષર્ય હતું અને લોકોને આદર-સંમાનની અવિકારણી માનતા.

જે સમયમાં લોકોને સામાન્યિક દરજને અતિ સામાન્ય હતો તારે જોતમ શુદ્ધ પૂર્વી ઉપરની સાત અભૂત રહેલોમાં લોકોને પણ સ્થાન આપ્યું હતું અને કંઈ હતું: 'નિર્બાધની પ્રાપ્તિ ન ડેવણ આદિજીને થાય છે, પરંતુ સુધ્યમાન એના અધિકારી છે અને સ્ત્રોઓ પણ નિર્બાધ આપ્યે કે કોઈ છે. એમણે લિઙ્ગશુદ્ધાને સ્ત્રી(અરેખર તો કામવાસના)થી સંચેત રહેવાનું કંઈ હતું, એ સાથે પોતાને જોગન કરવાનાર એક ગૃહરથ સ્વીના સંદર્ભમાં એમણે સ્ત્રોશક્તિની મહત્વા આ રીતે સમજાની હતી: 'એક ડાતમ મહિલા, જે કુળધાને જોગન કરાવે છે તે, એને જોગન સાથે ચાર વસ્તુઓ આપે છે: (૧) જીવનશક્તિન આપે છે, (૨) સૌદર્ય પ્રદાન કરે છે, (૩) આનંદ આપે છે, (૪) અજ આપે છે.'

ન્યારે સ્ત્રોઓને 'એ અંગુલમાત્ર શાનવાળી' (સ્ત્રોમી આઈ-એસ વર્ષનો ઉમરથી જ ચોખા રાખવાનું શરીર હો છે, પણ લાત રંધારું ગ્રાની કે નિદ એનો નિર્બાધ તરત હરી શકૃતી નથી, એ અંગળી વર્ષે ચોખાનો દાઢો દાઢા કુલે પદી જ નિર્બાધ હો તોય એના જીનને 'એ અંગુલ માત્ર પરિમિત' કહ્યું છે.) છે એમ કંઈવાનું હતું તારે ભગવાન શુક્રના ઉપદેશથી પ્રેરાદને અનેક લિઙ્ગશુદ્ધાની પરમ જીનની પ્રાપ્તિ કરી હતી. શુક્રાનામની એક કિંદુલી ખર્મ-પ્રયારાની અણિ કુશન હતી. મતુષો એને ટેવતાનો પણ એનો ધરેઠિપદ્ધ સંબંધનોને મંત્રમુખ અનો જતા અને એનો પ્રથમના કરતા. ગુહ્યપતિ અનાથપિલિના વરસી રાસની પુત્રી પૂજણી પાણીથી પવિત્ર ચન્દ્રાંશું એ એમ માનતાર ઉદ્ઘટુદ્ધિક એક આદ્યજીને વાસાનિક વચ્ચુદ્ધિના માર્ગ દર્શાવ્યો હતો. નિદાન આદ્યજી સાથેના એનો વાતાવાપ સંભળીને અનાથપિલિક પ્રસનન થયો હતો અને એનો દાદતમાથી સુક્લ કરી હતી. પ્રવજનયા ધારણું કરતે એ એક ધર્મનું પાલન કરવા લાગે અને નિર્બાધપ્રાપ્તિની અનિકારણિય જની રેણુદી જિતપત્રણથી અને શુક્રાને સ્ત્રોઓએ સમૃદ્ધ અને કોઈની નશવત્તા જાહીને પ્રવજનયા માર્ગ અનુષ્ઠ કર્યો હતો. તથા પિતા અને પતિ માટે પણ સંમાનની પથપ્રકારીકા એવી રહી હતી. આ પ્રવજનયાધરિણી લિઙ્ગશુદ્ધાનો કે થૈરોઓએ શુદ્ધિનો સાચો માર્ગ, ધન-સંપત્તિ અને સૌદર્યની નશવત્તા, આસક્તિને કારણે ઉદ્ભવતા દુઃખો, મૃત્યુ અનિવાર્યાની વિરોધ વિશે અનેક મનતીય વિશેનો કર્યો છે. આમ ઔદ્ધ યુગમાં સ્ત્રીનું વિકિતત્વ પુના વિસિત કરવા કારણું હતું. રંગાનો પુરુષોને અધીન હોના જતું પોતે પ્રતિભાસ-પન હોય તો સામાન્ય વલણો એના વિકિત-વના વિકાને રૂધી શકતાં નહીં. ભગવાન શુદ્ધ સ્ત્રીજીવનનો ઉનની આદર્ભી ગ્રાન સમજી રહ્યું હોય તો આમ સ્ત્રોશક્તિનો પરિચય કરાવ્યો હતો.

સંદર્ભસ્યુચ્ચ

- | | |
|--------------------------------|------------------------|
| ૧. દ્વાદશસંયુત | ૫. પારા. પૃ. ૨૦૦ |
| ૨. સિગાલોવાદસ્તુત-મિન્જમનિકાય | ૬. અંગુત-મિન્કાય-૩/૨૨૩ |
| ૩. મહાપરિનિષ્પાતાનસુસ-દીધનિકાય | ૭. સંસ્કૃતનિકાય-૧/૧૩૪ |
| ૪. દીવનિકાય ૧/૧૨૨-૩/૧૪૨ | ૮. થૈરોથને આધારે |

* શુક્રરાત ઈતિહાસ પાઠદાન આચુંદ-અધિવેશનમાં તા. ૧૭-૮-૬૨ ના દિવસે વાચાયેલી મહારાતે નિષ્પદિત

सुरतमां नवायेनुं शासन

३०. सुगरलाल चा. ध्यावीसा

मुख्य सभाई और अंजपा समय दरमान सुरतनो वहीवट 'सुरतदी' अने 'डिलेहर' नामना मेरे अधिकारीओं द्वारा थोड़ा हो। 'सुरतदी' वहीवटी अधिकारी होता, जो रे 'डिलेहर' लकड़ी अधिकारी होता, ई.स. १९४८ थी १९७० दरमान अनुक्रमे इनायतभान, रहनभान, मुहूरमहमेगभान, आसुहीनभान, अर्झमुखाद्वाहनभान, मुख्यभानभान, भैनभानभान, छैनभानभान, शब्दभानभान, भीजा शेष अवधा, सवापा मुहूरमह, नगरात्मान, दिवारभान अने नियतभाने सुरतना मुख्यी अथवा गवर्नर तरीके काम हुए। ऐ पठी ई.स. १९०७ थी १९१५ दरमान अनुक्रमे अमानतभान, द्यावतभान, अवाज अण्डुत डमेहान, महतीमभान, मोगभान अने सौवट अस्वरामान सुरतना गवर्नर तरीके रखा। अमना शासनमा १९१७ थी १९२० दरमान सुरतनो आवभपनाह कांड अध्येता २ तदरमान अपनी तुरनमभव्याभान १९२३ था १९२५ सुधी अने तुरतमभव्या पक्षी अनो पुनर्सोहरा अन १९२५ था १९३१ सुधी गवर्नर तरीके रखा। १९३१ था १९३३ सुधी गवर्नरना पद माटे संस्थाने अने जवाहरलाल यादव, ऐ समये जे कैठ अभीर मुख्य आवाहान मोटी बोट गेलक्तो ते गवर्नर तरीके निम्नांक मेगदी शक्तो। १९३३ मा सुरतमा अयंकर दुकान पड़ो होता। १९३३ मा अथवा छाईकोने महात ठारे तेगेगभान सुरतनो गवर्नर अन्यो तेगेगभान घोषा कितागाणा अने महत्वाकली उतो। अना समये वहीरी अने क्षक्षी सताए। अंक ४ दुकुंगना धायाए। कृदि। थठ। गवर्नर तरीके तेगेगभान होता त्यारे डिलेहर तरीके अनो बाई अेगवरभान होता। ऐ उपरान, तेगेगभाने वहीवटाना महद करवा माटे 'नवाया'(महत्वाकली गवर्नर)नो नवो होडो जोनो करी अना पर पेताना शील लाई युवाम-महमूही निम्नांक करी, ऐ अविष्यस 'सदहरभान' तरीके प्रसिद्ध थयो। आम, सुरतनी अधी वहीवटी अने लकड़ी सता तेगेगभानना ढाम्हा कृदि। थठ। ऐषे 'सुरतदी'ने वहसे 'नवाया'नो वधु जीवो अने प्रकावशाली जिनाय धारण क्यों तेथा नवाया शासनी शिवात तेगेगभानाथी थह.

तेगेगभान वेपार उपर वधारना कर नाप्या। ऐ वेपार माटे दिकुंगो पासेथा १२ टका, सुरितमो पासेथा ४२ टका, आमे नियमो पासेथा २२ टका अने तुरतपियनो पासेथा २२ टका कर लेतो। आ पर्यां ज्ञेक शकाय के उदिकुंगो पर करतुं प्रभाग्य सौधी वहारे हुए। महेश्वर अने नाशात्याय अ.अतोर्मा महदरप थवा सुरितम सुवाहाग्य 'हीतान' नामा दिकुं अधिनायोग्य नीमता। तेगेगभान पूर्व आउ मूँछ, आणेक्यां, रघुनाथदास, मनोहरदास, भिभारीहास अने ३५२.मे दीवान तरीके काम हुईं हो। अमा शम्भुभानना धाय कायरथ आवाज अने लाटा श्यराम अवाजाना होता। तेगेगभानन, हीतान तरीके भयाराम नामना नागर शुद्धरप होता। भयारामना जितानुं नाम व्यराम अने पुनरुं नाम डिरपाम हुईं। म गतरामने शरती भाषतुं 'सातुं' द्यान हुईं। ई. स. १९५३ मा अमना अवसान पक्षी तेगेगभाने अमतुं वर लाटा लाटुं हुईं। ऐ उपरान, द्यावता तेगेगेठ दिकुंगना वडवा अगन्ताथ लावदास तेगेगभाना ना समझाक्ली होता। अगन्ताथ अंगेविना द्यावत होता। अंगेविनुं अगन्ताथ पासे यार लाय शपथानुं लेणुं हुईं तेथा अनो डें कराने मुंगाई वही गया। अगन्ताथ युक्तपूर्वक त्याथी अटक्कोने पूना अनाङ्गो पासे गया अने त्या लकड़ी होडो स्तीकायो। अंते अमले अंगेले ने ३००० दिंदायेनुं लकड़र अंदकुं करवानो महद कराने अमनी जितान मेगदी होती। १९५३ मा आ अस्वर अने साउसिक नगरशेहरु अद्यान थयु.

पठिक

सप्टेम्बर/१९६१

६

तेजप्रेगभाने १७३३ थी १७४५ सुधी शासन थ्युँ। १७४५ मां संबहुष्टिना रोजर्था ८० वर्ष पाकारे छ'मरे केतु अवसान थ्युँ।^५ ए पछी किल्वेहार तरीके काम करतो ऐनो आई बेगवरभूमि सुरतनो नवाय थयो। १७४७ ना इम्बुआरीमां बेगवरभान पक्ष वृद्ध वये अवसान पामतां ऐनो आ सद्दरभान सुरतनो नवाय थन्यो। सद्दरभाननो पुन वाक्दरभान सुरतनो किल्वेहार थयो। १७४८। तेजप्रेगभाननो जमाई मियां अचन उहै भोडीहुदीनभान सद्दरभानने हातीने सुरतनो नवाय अन्य ए १७५१ सुधी एटी के वश वर्ष नवाय रखो। १७५१ मां सद्दरभानना एक किल्वेहार सीधी भस्तुहे जि अचनने हुर द्वाने वडीवडी सत्ता पेताना हातां लीधी तथा सद्दरभानने फरीया नवाय अन्यां साडी रस्त १७५५ मां अने सद्दरभान १७५८मा भूत्यु पायो। सद्दरभानना भूत्यु पधी इरिसभा नवाय थन्यो, परंतु यिया अचन उहै भोडीहुदीनभान एने द्वानने छ. स. १७५८ मां फरीया सुरतां नवाय थन्यो।

ए पधी तरंत व आतिथि अधार्योने लाभ लहौ, १७५८ मां अंग्रेजोंके लक्ष्यों भ पक्षां अ सुरत छती लीहुँ। १७५८ नी ४ थी भार्य थोला कळळथा नझी हरवाओं आउयु^६ (१) सुरत अवर्त्त तरीके भार्यां अचनों चालु गयनो। (२) इरिसभानने नायण अवर्त्त अनावयो। (३) सुरत हिल्वो अने वाहन अंग्रेजोंसे सोपायो। आ करारोंनो मुख्य आक्षण हेर्वाकर क्षेत्र अने ताराया सुरत हिल्वा पर मुख्य-भवनी साथी अंग्रेजोंनो दृश्य अनियन्त्र लेक पक्ष इन्को थयो। आम, १७५८ र सुरत उपर अंग्रेजोंवर्षभूमि रथपायुँ छतां अम्बेहे नवायना पहने चालु राख्युँ। आ समये सुरतन परती धगभग सात लाख एटीही हती,

यियां अचन उहै भोडीहुदीनभाने १७५८ थी १७५९ सुधी शासन थ्युँ, १७६१ नी २७ र इम्बुआरीमां ऐनुं अवसान थां भूमध्यीनो अंग्रेज सम्पर्के अनो पुन कुत्सुहुदीननी सुरतनो नवाय तरीके निम्बुक द्वारा, कुत्सुहुदीने नवाय तरीके भीर हाईकुद्दीन अद्दमभान अहादुर^७ नाम धारण थ्युँ अंग्रेज सरकार हाईकुद्दीननी निम्बुक माटे हिल्वीता मुख्य आक्षणती पदवानगी भागी नहि एक्तु^८ ४ नदि, सुरतनो नवायनो के प्रतिनिधि मुख्य दरभारमां ऐकतो हतो तेने पाणो आवानी लहौने मुख्य आक्षण साथीना भास्यो क्षपी नाम्या। नवाय हाईकुद्दीन राय वर्ष सत्ता बोग्वां १७६० मां भूत्यु पायो।

४. स. १७६० थी १७८० ल्लोनो समयगाहे सुरत गाटे वेपारुद्धि अने विक्सनो हतो ज्यापे १७०० अंग्रेजीं वीस वर्षनो आणो एती अने पतननो हतो। हाईकुद्दीनना आसनकालम १७८८ नो जोडु व.नांगोडु थ्युँ, जेनाथी शहेरी वाली इमारतो। तेम भक्तो भिनाशायो अने कमानो तूटी परावा, लगभग अन्धु शहेर जमीनहेस्त थ्युँ। वाला आणगो अमो द्याई सर्वा। १७६० मां भोटा हुक्का इच्यो, नो 'सुडायो शाग' तरीके ओग्यात्य क्षेत्र घेऊना ओग लोधा। आ अंने इतरती आइतोमे सुरतने अलहूक तुक्कान थ्युँ अने ऐनी पायमाली सर्का।

आ अससामां स्त्रतभां वश लहूर अने वश भानगी आग हता, बाहेर आगेमां नो एक औगभवाडी^९ तरीके ओणाभातो, ए ऐगमपुरामां आवेल हतो। अन्ने आग 'भद्रमूर्ती आग' तरीके ओणाभातो, जे सवालपुरामां लेता, आ आग तेगेगभानो वांचाव्यो हतो। तीन आग्यु^{१०} नाम 'अहवाल आग' थ्युँ ते कतारायाम हरवाल अहार हतो अने नवाय हाईकुद्दीने वांचाव्यो हतो। आ आग ज्यावाना

॥३॥ भाष्यसेनां भक्तान् पादान् नवापदामां आवेकां तेऽपि लोको एते 'कुरुभी पाद' तरोऽप्तोऽपापातां
 ॥४॥ नानगी आजोऽनि ईरट ईनिया कृपनीनि देवदीना प्रभुभ प्राकृसनो भाग, अङ्गेनेना हवाइनो
 ॥५॥ भाष्यमां आवेको भाग अने 'उच्च आर्द्धनेना समवेक्ष थयो' होतो. १७४३ मीं सुरतनी सुराकाते आवेका
 ॥६॥ और नामना युरेपियन प्रगसीजे 'उच्च आर्द्धनेने अधा युरेपियन भाजामा सौथा सुंदर भाग तरोऽप्तो
 ॥७॥ भाष्यानो होतो.

हाईकुहूनना भूत्यु खण्डी ऐना पुन निगङ्कुहूनने अङ्गेनेमे सुरतनो नवाप अनावेदो निगङ्कुहून
 ७१॥ मध्य वर्ष सता जेगानीने १७४४ ती ८ मीं जन्मुआरीमे भूत्यु पाम्हो. आ नवाप वशो रैविक होतो
 ७२॥ एमेट आजे ओल्ले पथरीमा हर्दी तरोऽप्त रहोने अ शासन कुर्वु हतु ७३ ऐना भूत्यु खण्डी ऐना
 ७४॥ नेवाई नसीडुहूनने अङ्गेनेमे नवापतु रह आप्त्यु. ७४. स. १८०० मां ऐनी साथे न्दरार की अङ्गेनेमे
 वापती अधी सताओ ऐनाना कायमां लीपी अने जेवी जेगवार्ह झरी के अङ्गेने दर वर्ष
 ७५॥ ०,००० पाँडिं (वशलग गेड वाप इपिया) अने सुरतनी जिपननो पांयमो भाग नवापते आप्तशे.
 ७६॥ मूर्खाम, नसीडुहून भाव नामनो नवाप अन्मो. ७६. स. १८०८ मां नवापने वैष्णिक जेवलना पांयमा
 ७७॥ नामने अद्वै उपिया पवास इलाजी निश्चिन रम आपातां नक्की थयु; अर्द्धे हवे ८२ वर्ष अधी
 ७८॥ नामने इपिया होइ लापती रकम अङ्गेने तमद्यु नवापने भगवानी होती.

७९॥ ता. २३ मीं सप्टेम्बर, १८२० ना रोज नसीडुहूनभान्तु निधन थां अङ्गेनेमे ऐना पुन
 ७१॥ ईकुहूनभान्तने नवाप अनावेदो. ऐ भय सता वगरो नामने नवाप होतो अने अङ्गेनेमे
 ७२॥ निहेयानाथी नवाप तरीके थाकु रहेके. ऐना पितामी नाइक एते खण्ड अङ्गेनेमे दर वर्ष इपिया
 ७३॥ १८ लापती रकम आपातां हत्यायु. ईकुहूनभान्त सुरतनो छेवो नवाप होतो. एतो जन्म
 ७४॥ स. १७८२ ती १८ मीं जन्मुआरीमे थयो होतो. १८२० ना सप्टेम्बरमां ऐना पिता नसीडुहूनतु
 ७५॥ मूर्खान थयु, न्यारे अङ्गेनेमे नामनो रज्जानिष्ठ १८२३ ती २७ मीं अङ्गेनेमे थयो. ऐना
 ७६॥ जियालियेक्मां ऐ वर्षनो जिक्कं थयो ऐ भाई योक्कस कारण्यो होतानो संख्य छ. १०

७७॥ अङ्गेनेमे दीतान तरीके भीठासम क्षयस्थे थाडो समय डाम कुर्वु हतु. दीतान इगिया पासे
 ७८॥ नाणीना दिवसे नवापती पादभ्या आयी नवापतो प्रसंग आ नवापना सन्दर्भां थयो होतो. आ
 ७९॥ नामना यासनक वर्षम १८०७ ती २४ मीं एविले सुरतनो लाप्यक. आज लांगी, ए नृथ दिवस
 ८०॥ तुक्की याली होती. आ आगमां गोप्युर, गेयम्पुरा सल्लालापुरा भागानाम, अपादिया यड्को,
 ८१॥ प्रवृत्तियामाप वारीइपिया माल्हापाठ छण्डोपाठ राण्डीत्ताप, रिया सेनानी यड्को बोरे परानां
 ८२॥ मेंकुहै दस लम्ब अन्नो. आगामी आप थयो नाथ वर्तु भाष्यसेनां भरसु थयो. सुरतना ईतिहासमां
 ८३॥ मा साथी न्यारे लम्बाने अने पितामाप आय होती. ऐ वर्षी ऐ ज राती २८ मीं योगस्टे प्रवय-
 ८४॥ तारो रेल आयी, जेल्लु सुरतने पादामर तुक्कसन कुर्वु. आ रेल वर्षते डिक्का आगम सरा छ
 ८५॥ पाय्यो हतु ले परद्यो एक्के ईट्को आनाभारामी सर्ल ईश अनो अचाल आपी शारे.

८६॥ आ नवापतु भेदु २४८ ना तीव्यित्र तुक्कसना भरदार वद्वलग ई पटेल त्युजियमे भेद्यन्तु ८७.
 ८७॥ ए चित्र परद्यो सुरतना नवापतो ऐशाक हेवे होतो अनो ज्ञात आवे छ. सेहेट वस्त्रामां सल्ल
 ८८॥ भेद्या नवापे अंजनता लागा पर ऐतानो दाय रेक्केने छ. चित्री नाचे इतरसी भागमां लभावेती
 ८९॥ चू धक्कियेनाथी एती भाडिता भेदो के क आ नवापतो जन्म हिक्की सन १८४८ ता २४४७-१८४८
 ९०॥ मूर्ख भट्टीनामा पांयमी तारीषे (७४. स. १८८२ ती १८ मीं जन्मुआरीमे) थयो होतो. ऐनो राज्यान-
 ९१॥ भेद्य छिक्की सन १८४८ ना जिवाह भाडिनामी १८ मीं तारीषे (७४. स. १८८२ ती १८ मीं योगस्टे)

पाठ्यक

सप्टेम्बर/१८८१

११

थथा होता, जिने 'काहुदीवाला' अंटले के 'पूर्व चंद्र केवी तंजस्वी' वर्षीयसामां आयो। छ. जे उपर्युक्ते अने उपर्युक्ते अंटिना सौपैठ अने अदादुर सिपाहीबाट तरीके मिरहायगां आयो। छ. नवाख्तुं यि घूम सुंदर सुरेख अने पृष्ठ छ.

नवाख्तुं अदादुलीदातुं ता. ८ भी अंटेस्ट, १८४२ ना रोज अवसान थयुं। आ नवाख्तने डोर्म पुत्र न होता, भाव अभियाकुन्तिसा नामी पुनी हत्ती तेथी अंटेस्ट भीग डोर्म नवाख्तुं पहा आपत्ता १८४२ भां सुरत भावसा क्युं।^{११} सुरतावडिका ५ था मुख्य-धर्म उत्तावी देशमां आयो अने भाव मुनियन डेक्ट इरडता रहो.

नवाख्तना ज्ञाई अने अभियाकुन्तिसाना पति भीर गद्दरभाऊमे नवाख्तुं पह मेषावत १८४४ भां छग्वेन्द्रीनी मुखाकात द्वावी, भीरभवाम इपराम नीलकंठ घूर्ण छग्वेन्द्रीनी मुखाकात बेनां आ सुरती होतो, अनी आ छग्वेन्द्रीनी मुखाकात हरभावत अनी पत्ता अभियाकुन्तिसातुं छग्वेन्द्रीनी अवसान थयुं। छग्वेन्द्रीनी हत्ता अतों गद्दरभालीते नवाख्तुं पह यो न रह्युं, हत्ता अंगमुं तथ अनी ए पुत्राच्यातुं नारिक ऐन्तर्न अ. ५२,८०० था वारीते इपिया एक लाख अरवामी आय्युं। नाइरभवीं १८६१ भां सुरतमां सौ-प्रथम द्वापडनी भिव शह द्वारा, जे 'नाइरभवीं भिव' दरी ओणाभाती। आ पडेव करवा भाट अने 'सुरतमां आउनिक डापड-ड्योगमा अंगेता' गणी शक्षा, भाविकी अववतार अव्यापे अ भिव 'सुरत डोर्म भिव' भर्ड ज्ञानाधाय अ. १८६३ नी २१ भा अंगस्टे नाइरभवीं अवसान थयुं, अनेते पुत्र न होता, अनी पुनी छिय उन्निसा (डेवी लाजी अंगम) तथा अना पति भेजाना न रहन भार आलभान अने भीलु पुनी रहीमुनिसा तथा अना पति भीर गुलामभाने अंटेस्ट सरकार ऐन्तर्न आपाती दती, सुरतमां भाव दानासाहेमीनी हरचाहो ने भिन्नतो। १८८२ ना नवाख्तनामां तुरी गये होता ते आ गुलामभानामे ऐताना अर्थे द्वारी अंगातो होता।^{१२} १८८८ भां रहीमुनिसाना अवसान पक्षी पशु अंतो संतानाने सरकार तरक्षी पैन्थन अगतुं हुतो।

आम, सुरतमां १७३ था १८४२ सुंदी अंटले के १०८ वर्षी सुंदी नवाख्तुं शासन रह्युं, आ सभय हरभावन मुख्यत्वे भाठ न नाहो थया, तवाख्ता शासन हरभावन सुरतनी समुद्दिः अने लहोगवाला वहानी गही। सुरत आग रेव वाजेहुं द्वापाल धरीकर्ते अंटेके फुरती आइतोतुं भेज अन्युं, ए साथे साना भाटेना अटपटो अने लूटटोये अस्थियता तथा अस्वामीनी सर्वुं सुरत सोंचायातुं गयुं अने सुंदर विकल्पतुं गयुं अतों सुरत न रह्युं। लोगोनो रग्यो भिन्नज तेम लहोरीपछु आनंदप्रियता अने अंटेदिलो द्वारा न पड्यो, सुरतना रोनक अने रग्यानता चालु रही, नवाख्तोना शासने सुरतना ईतिहासमां एक विशिष्ट आतीगण एकरखनो उभेरो कर्म अम छही शक्षा,

पांचांत्र

१. "सुरत डिरिक्टर जेटिवर, अमदावाद" (१८६२), प. ११३

२. अंटेन, प. १३४

३. अंटेन, प. १४१

४. ईश्वरबाल छ देवाई : "सुरत सोनानी सुरत", (सुरत, १८६८), प. ६५

५. १७३ भां ज्ञानामां उत्तराम फाय अंगमी डेवियारीने तांद्रे अविष्यमां दीवान थया होता,

सुरतना गेपीपुरामां आयों पशु शेगतां नाम अने निवासरयानती थाह अपावतो 'हिरपाराम भाईनो अन्यो' छे,

૬. એમ. એસ. ડોમિનિયેન, "દિવારી ઓર ગુજરાત", વા. ૩ (અમદાવાદ, ૧૯૮૦). પૃ. ૫૬૩
 ૭. આ દુષણ વિ. સં. ૧૯૪૭ માં પડ્યો હોવાને લીધે એ 'સુરતળી કાળ' તરીકે ઓળખાય છે.
 ૮. એમ. એસ. ડોમિનિયેન, ઉપર્યુક્ત, પૃ. ૬૬૨-૬૨
 ૯. નર્મદાશંકર લાલચંદ્ર પંડ્યા : "સુરતની મુખ્યત્વાત્મક લક્ષીકત", (સુરત, ૧૯૮૧) પૃ. ૫૭
 ૧૦. કદમ્બ અંગ્રેજીને જેને 'નવાખ' તરીકે આખું રાખવા ઠિકાર કર્યો હોય અને એથે અંગ્રેજી
 અવિકારીકીય પાસે રજૂઆતો કરીને પોતાના હક્કનો સ્વીકાર કરાયો હોય એવી શક્યતા અરી.
 ૧૧. જ વર્ષ એટી ૧૯૪૮ માં ગવર્નર-જનરલ તરીકે આવાનાર દોર્ડ ડેવલપરીને આ જ નિયમને
 અમલ કરી અનેક રાખ્યો આલસા કર્યો હતા.
 ૧૨. અયારે સુરતના રેલવે સ્ટેશન સામે નૈન ધર્મબાળા પાસે 'ગુલામભાના કર્પાણિ' નામનો વિસ્તાર
 છે, આ વિસ્તારમાં જ ગુલામભાનું નિવાસસ્થાન તેમ લગ્નીર હશે એમ ભાતી શક્ય.
 * ગુજરાત કાર્યક્રમ પરિષદના આધું-દ-અધિવેશનમાં તા. ૧૬-૨-૬૧ના રોજ વંચાયેલો મહત્વનો નિયંત્ર

સુરતમાં નવાયોહું વંશવૃક્ષ

તેજમેળખાન (૧૯૩૩-૪૬)	બેગલખાન (૧૯૪૩-૫૭)	સંક્રાંતખાન (૧૯૪૭-૪૮ અને ૧૯૫૧-૫૨)
પુત્રી=મિયાં આચન (૧૯૪૧-૫૧ અને ૧૯૫૮-૬૨)	પુત્રી=વાડરખાન	
દાર્શનિકુદીનખાન (૧૯૫૩-૬૦)		વાડરખાન પુરી=અલી નવાજ જગ
નિଆમુદીનખાન (૧૯૫૦-૬૬)	નસીરુદીનખાન (૧૯૫૮-૧૯૮૧)	
		અદ્દારુદીનખાન (૧૯૮૧-૮૨)
		પુત્રી અભિતયારુનિસા=મીર નાફરખાનીખાન (મૃ. ૧૯૫૩)
પુત્રી લિલા ઉલ્લેખ લાડલી એગમ=મીર આલમખાન	પુત્રી રધીમુનિસા =મીર ગુલામભાના	સર્પેરખર/૧૯૬૧
પથ્યક		૧.૩

સૌરાષ્ટ્રમાં ગાયકવાડી સત્તા

શ્રી ધીરુભાઈ પુરેહિત

ગાયકવાડ કુદુંબમાં મૂળ પ્રકૃષ્ટ નંદાજીરાવ હતા. આ કુદુંબનું મૂળ ગાય પૂર્ણ જિલ્લાના હોવી તાતુડાવું ભારે ગમ હતું. કુદુંબને મૂળ જંતસાન ખેતી હતો, પણ નંદાજીરાવ મારા પ્રદેશમાં ભોર જિલ્લાના દરવાળ પાસેથી કોઈ આચાર માયોનું ટોણું વિદેને જતો હતો; અતુડુંપાઠી પ્રેરાઈન નંદાજીરાવે જાયોને ઉહેલાભી ક્રમાણ પાછળ સંતારી રક્ષણ હતું. ક્રમાણ-દરવાળને મરાડીભાઈ કવાડ કરે છે; મારાથી જાયો 'ગાયકવાડ' હેઠાવાં. ઈ. સ. ૧૭૨૮ માં ફિનાજીરાવના સમયમાં ગાયકવાડી દવરીના 'દાટિંગ' અન્યા નંદાજીરાવ પિલાજીરાવના પ્રપિતામણ થતો હતા.

ગુજરાતમાં ગાયકવાડી રાલયના ઉદ્ઘાતનો ગ્રારંજ જી એ સહીના પૂર્વવર્ધમાં થયાનું દેખી શકાય. મુખ્યસત્તા વારે સર્વનાશને આરે માર નામની જ સત્તા હતી; મરાડીઓએ આ તક ઝર્ણી દીધી.

સત્તારાના જ્ઞાપનિ મહારાજાન રામનારામે પોતાના એક ચીંધાસુ અધિકારી અડેરાવ દાખાઉણે ઈ. સ. ૧૬૬૮ માં ચોથે કને સરદેશમુખી ઉદ્ઘાતાવો અધિકાર આપ્યો. ઈ. સ. ૧૭૦૬ થા ૧૭૧૬ ચૂંધીભી ઘરેલાની કુદુંબીએ ગુજરાત-ભરમાં ફરી વળી અને સૌરાષ્ટ્રમાં સોંધ સુંધી કરી વુંટ્યાની કરી. સેનાપતિ દાખાઉ સંચે કેંદ્રે નાયન દામાણ ગાયવાડ પણ સાથે હતો. દામાણના પુત્ર પિલાજી ઈ. સ. ૧૭૨૨ માં શિહોં ઉપર આક્રમણ કરું હતું.

સને ૧૭૫૩ થા ૧૭૮૮ સુંધી ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર મરાડીઓની સત્તા સર્વોપરિ હતી. પુનાના પેઢાનાં તામેહર તરીકે ગાયકવાડ વડોદરાથી આસન ચલાવતા. પેઢાને સાથે અમદાવાહ રહેણે હતો. છેલ્દા સુંધી આચાર શેલુકુંક સાથે ગાયકવાડને જરૂરો થતી ગુજરાતમાંથી પેઢાવાઈ સત્તા નાયૂં થઈ અને ગાયકવાડ સેવસરી થઈ રહ્યા, સને ૧૮૦૨ ના વસેઠના દરારથી પેઢાવાઈ સત્તાનો મુખ્યદંડ વાગી ગયો. આ સમયે વડોદરામાં આન દરાવ ગાયવાડ હતા તેમના દીગાન તરીકે આપાળ રાજુ હતા. સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં નવાય હાલીહાલાન, જમનગરમાં જમનગરાણી અભસિંહજી અને કરુંભાઈ કરુંભમહામદ જમાદારની સત્તાએ હતી. જમનગરના મેરુ અચાસ, જૂનાગઢના અમરાણ દીવાન, કરુંભાઈ કરુંભમહામદ જમાદાર, જાસનજરામાં વખતસિંહજી અધા પોતાના રાજ્યાંવસ્તાર વધ્યાર્થી જવાની દેતરથાણી હતા. સાર્વાંક જાસાંત હતી. પેઢાની ચોથ સરદેશસુંપી જમા જોનેતલથી અને જેવા અને હૃપાણાં નામે બ્રાહ્મ લુટાતી હતી. 'આરે તેની તલવારનો એ બુગ હતો. મારાણ અને અવ્યવસ્થા નવી ગવ્યા. ઇયતના હિતની ઝાઈ પરવા કરતું ન હતું. અણ પશુથીએ બ્રહ્મ જીવન હુવતી હતી. મરાડીઓના આગમન આહ ઉદ્ઘોગાનો વિનાય સર્જાની હતો. સગર ગુજરાત બરાબાદ થઈ ચુક્કું હતું.'

ગુજરાતની આ હદ્દ્યદાવાક સ્થિતિથી દર્શિત થઈ કર્ણલ વોકરે ઈ.સ. ૧૮૦૬ માં જેના એક પત્રમાં જાણાયું છે કે 'આ દેશ ચોર-દુંટાસાયોનું કેંદ્ર થઈ ગેયો છે, દેશ જગત જેવે વેના છે અને ત્યાંના રહેવાસીઓ પરીણ તથા ભૂમે મરાણ કેંગળ છે. આ દેશમાં આવાએ અને દેશનાં જ પ્રવાસ કરી થક છે, વેપારીઓ માર મુખ્યેણી જ વેપાર કરે છે. જેના અધિકારીએ પરમેશ્વરના ચાપદ્ય છે. જગીરદારી તો ઈશ્વરની દ્વારી વંચિત છે, સૌનિહીને અનિશ્ચિત રથને વસડાઈ જતી નૌકાના બેસી દેખ રહી ગી દીધો છે, કાદાશાહી ઇરનામણી આપાયેલી કાઈ પણ આનિતું રાખન થતું નથી, રાજ્યમાં કાયદો કે વ્યવસ્થાનું નામનિશાન નથી.'

“दामाणाज्ञाना थेखक दार्शनि मेंधे छे तेम आपो देव (गुरुरात), पेशवा अने गायकवाड वर्च्ये वहेंचाई गयो होतो; अणज्ञानीया गेसा पदववा एं अमेनुं मुख्य धैय हुं”.

आवा समये काहियावाडामा दामाणराव गायकवालां घोर्ह इरी रहों इतां. आ दामाणरावनी क्षम-
गौरीया पुक्क थर्ह छर्पत शाकुओ अने “सभीर-लक्ष्मीहुं”नो जिताअ आपो होतो. आ दामाणराव
पहेलाहुं ठ.स. १७२० भां अवसान थयु. त्यारपटी अनो अनीने पिलाणराव सत्तास्थाने आवो;
अे आहोश शासक होतो. अनो पुरु दामाणराव अने खूप उकियाणी मुत्सदी अने कामेव राज्यपुरुष
होतो. अना समयमां अमरेतीमां प्रथम थाळु नमायु अने सोराष्ट्रां गायकवाडी सतानो साचा
वर्धमां प्रारंभ थयो. आ दामाणराव खालीने घेताना सेनापति शिवराम गारडी भासहत अंडशीनी
पसुखात यालु राखी, आम इतां १६ भी सहीना प्रारंभ पहेलां गायकवाडानं सौराष्ट्रां अंडशी
डिवराववा सिवाय रक्षाया सता नहोती. दामाणराव अने धार्मिक उत्तिनो, शिवास्थापयनो शोधीन
अने मुत्सदी होतो. अना पिता पिलाणरावो छर्पति शाकुओ तो. ३-५-१७२८ ना रोज आदेश-
पत्र दारा “दावी” आम आस्तुं हुं अने पेशवा आणुरावे अने “सेनाभासभेद”नो जिताअ
आपो होतो.

दामाणराव खालीना समयमां ओभामंडळमां भावा भाषेकना वंशजनी सता होती (आरी खासे
ओभामंडळाना तमास नाऱ्यवेशानी वंशावणाच्या छे, ने अवे अपरतुत छे), परंतु वगबग १७४५
सुधी ओभामंडळां वाविरेती स्वतंत्र सता यालु होती, दामाणरावना समयमां वाविरेतुं राज्य
व्यवस्थित हुं अने दारकानी यात्रा भारे लोटाने आकर्षी रहुं हुं. दामाणराव पुक्क यावा-निमित्ते
दारका ज्ञतो अने धर्मकर्त्त्वे करतो. अवरेतीनो प्रदेश मेलव्या पक्षी दामाणराव लालीना जोहिव रालनी
इवरी साचे लम्बंधव्यां लेगेयो होतो. अशु काहियावाडाना अनेक स्थानां पर्मरक्षान व्यापाव्यां छे,
पवलीपुराना अडेता पासे लोवियाला गामना अडेतां अेक शिवालयनी भांत ५२ अेक पदात्मक
शिवाविषय होतो. (अने आ लेख छे डे नहि अनी जाणु नयं.)

आ पाच लीटां थेख नवे मुक्क होतो :

१ श्रीशीवचर र यी तत्पर ॥ दामाजी ३ गायकवाड नीरंतर ४ १७५४ जेष्ठ ५ चुद बीज
वास्तवमां काहियाती लेखनरौलीना होये लेखनी शान्यमयता भारी गर्ह छ, अरेभर आम होतुं
नेहिये :

“श्रीशीवचरथी तत्पर, दामाज्ञ गायकवाड निरंतर.”

आ उपरात ऐत शंभोदर्भां विस. १८२३ भां गायकवाला अमरेतीमां रहेता अधिकारी
क्षमाण शामरावनी देखेद नाचे भोटा अर्चे “दामाणराव” नामहुं सुंहर तणाव भाववामां आस्तुं हुं,

झे छे के आ तणावेने १० लीटानो शिवालये रामवाडीना शोवारे होतो त्याची होवे ऐव
सार्वजनिक पुस्तकालयना वातमां पठचो छे.

१ श्रीगणेशाय नमः ॥ श्रीरण्डोडसर ॥

२ श्रीभगवंत दावा वि...कुलकर्णी मौजे ।

३ जांव(गांव) जलांव प्रति वाहे देश—॥

४ श्रीमत पीलाजीसुत दामाजी गायकवाड ॥

५ ६ सुमेदार सम्हेरबहादर

६ याणी तलाव कराविला...॥

पथि

संस्कृतम्/१६६१

५५

७ जीवाजी पट्ट... ॥

८ श्रीराणा श्री...त जाला ॥

९ कडिया ..ही...राज संबत ॥

१० १८२६ माघ सुद ५... ॥

आ तणाव 'दामाक्षसर' कहेवाय छे, पथ ऐना अधारनार दामाक्षरावे तो लेखनी पंक्तिमा "रखेंडुसर" हुँ छे ए नोंधपात्र छे. आ वेख मुकामा पछी पथ ५० वर्ष सुधी द्वारकामा वावेरो अने वाढेर राजपत्रानु' ०८ राज्य हुँ.

संबत १८३१ मां गेविंदश्रव गायकवाडाना भाता धनाभाई द्वारकानी यात्राचे आयां त्यारे काडियावाडाना ऐना हीवान आमाज आपाज ऐभनी साथे हता अने तणावनो अर्णोद्धार हर्यो हुतो ऐना शिलालेखनी नक्ष भारी नोंधपात्रोभां छे, पथ विस्तारलये अदी नोंधव नथी. उपरात आ तणाव समरवाना वडोदारी आदेशपत्र काडियावाडाना सूता विठ्ठलराव देवाजु ५२ आवेलो ते पथ विस्तारलये अने नोंधव नथी.

दामाक्षराव भीजना पिता पिलाक्षरावनो अमल १७२१ थी १७३२ सुधी आद्यो. ऐक्ये १७१८ भा सोनगढाने किलो ४५० चे करी ती गायकवाडानी राज्यतांत्री २४४८. ४३. १७१८ सुधी सोनगढ खाटनगर हुँ. पिलाक्षरावे युजरातांग गायकवाडी सतानो लारे विरतार वधायो. ऐक्ये उभाई तथा वडोदारा ४५० चे करी. वडोदारामा ए समये सुरतना नवाबनी लालांबीभी नामे अप्रतिहित आईरुं शासन हुँ, पिलाक्षरावे ऐनी पासेश्वा वडोदारानो क्षजने मेंगव्यो, पथ येशवाना सुमेदार अभ्यसिंहे वडोदारा ४५० चे करी शेरभान आपाने सूतो नीझो अने १४-४-१७३२ ना राज पिलाक्षरावतुं झून करायुं पिलाक्षरावना पुत्र दामाक्षराव भीजना समयमा शेरभान आपाने हरावी वडोदारानो १७३८ भा क्षजने लाधा ने छे १६४८ सुधी वडोदारा गायकवाडाना ४५० गजां रहु. दामाक्षराव भीजनो अमल ४३. १७३२ थी १७४८ सुधी आद्यो. ए ऐना पिताया पथ सवाये समर्थ तीवडयो. ए पथ 'सिनाभासपेक्ष' हुतो. ४३. १७४८ भा काढेऊ तपकारे सौराष्ट्रनी याई दरभ्यान वंशाना ५२ हुमवो. हर्यो. हीवान रखेंडुल योताना 'तवारीचे सोराष्ट्रमां आ हुमवो गायकवाडाना दीवान आमाज एक्ये एम जाण्यावे छे. वेरो ए आस चाल्यो. तोपभाराची किलवाना ए मिनारा तूटी गया, पथ आभरे घेरा उठावाचे आद्यो गयो.

आ विषयमा श्री कडानवास तापीदास वैष्णव जल्दावे छे के आ समये नवाय दामिद्यान तथा दीवान रघुनाथजु अने रखेंडुल ने मनदृष्ट लेनु' हुते तेथी वंशाना वेराभा दीवान आर्थिक्या तटस्थ रत्ना हुता एम श्री शंखप्रसाद देसाईना नोंध पस्ती लाजे छे.

आ समय दरभ्यान पडोदाराना राजवी गेविंदश्रव गायकवाडाना दासीपुत्र मुकुंदराव गायकवाड अगवे करी, अमरेकीमां थाणु' नापी उपदेश शह डेयो. ऐक्ये वसावडाना नागर देसाईने अमरेकीमां ३८ हर्यो तेथी दीवान रखेंडुल एम अमरेकीने घेरा वाली एक उसाडगां देसाईने मुकुंदरावा. मुकुंदराव अमरेकी छाडी आद्यो गयो.

सौराष्ट्रमां गायकवाडो राज्येना अंगत भामलामां पथ भद्र रहता. दीवान अमरेकी हत्या पछी अवासपाटखुना ऐना अनेवी अर्णाई अर्णीलदात देसाई दीवानकुटुं अने मेंरभी मूळी घोत शिंदेर गदा अने मेंरासिरव गायकवाडे वात हरी. आ प्रसंगे ऐक्ये योताना पुत्र उभियासंकरने लमेव पत्रनो उल्लेख श्री श.क. देसाईना 'पितुर्पत्र'मां नीजे प्रभाषे छे:

"અરથાણું નેત્રમણી ઉત્પિદ્ધાશંકર શ્રીમોરખ્યોથી અમે દ્વેષાદમ સીહેર તરફે રવાના થયું આયી શ્રીમત ગાયકવાડ મોદારીરાવ તથા ઇપાળ ચિંદેની સરકારની ભાવઘૂમીમાં બેટ થઈ તમારા મામાના બાતની વાત કોણી સિંહે તો ઉલ્લા જ થઈ ગયા અને તરફારની સુંધ ઉપર હાથ નાખો કે તરકાણું સુંધે નાખીયે તમે કરો અમે હા કાણી ખીંગે જ દને હેઠાં કુરખુગઠ તરફે રવાના થઈ અમે કાણીનું ભેગા ચાલા આજકાલ નવાય આયે તોપ માંડાણે બાંધુને નવાખ છોડે વેર લાવશું એના મેડાં જેવા શ્રી સેમનાથ દ્વારાને દીપમાળા કરવી શ્રીહારીઓથરાની મોડાં ચયાળવું થાગ ધરવો જમાતખાને ડેલોએ સુવાડને ખીંચ ચિંદાયુને સાથારા રામચા નવાયનું કાંઈ સુંધે નહિ મેરખ્યીમાં રેખા કરવાને અદ્દુલસ અહુ સરોણી સર્વત્ર ૧૮૪૦ ચઢતર સુંધ ૪૦" દીવાન અમરણુના સમયમાં જ્યારે અમરણ જાલાવાંમાં પેશકશી વસ્તુ કરવા ગણ હતા ત્યારે નવાય હામિદખાનની માતા સુનનથાઈ તથા બાંધવાના આયી એદ્દખાન અને મુખ્યિત્યારખાને વંધળાના કસાતી નાગેરાને હેડી વંધળી કર્યાને કરી લીધું. આ વખતે અમદાવાદને સુંધો આખુરાવ મધીપતિરાવ પણ ગોત્યારુથોગ આ પ્રદેશમાં હોય; એણે મેરી રકમના બદલાંમાં વંધળાના આ હલ્લાબાં બાંધવાના આખીઓને મહા કરી. અમરણને આ સમાચાર મળ્યો એણે તરત અની વંધળાને વેરી લીધું. વંધળાને કંદને પાણો મેળવી અમરણને મરાણ કરદાર સાથે સુંધેક કરી આખીઓને માઝી આપી. આમ સૌરાષ્ટ્રના નિપ્રતિનિધિ ગાયકવાડી સત્તા પેતાનો પ્રભાવ ૫.૨૦૮૮ જતી હતી, પરંતુ ૪.૩. ૧૮૦૦ ચુંધો ખાંધ્યી વસ્તુ કરવા સિવાય એની અન્ય કાઈ કામગીરી નહોટી. આ ખાંધ્યી સામે સૌરાષ્ટ્રમાં અપણક વિરોધ જાગ્રે, કેર ટેર બાંડો થના લાગ્યા. આ સમયે કન્દા નોંધર વડારાને રિસિડન્ટ હતો તેણે પ્રજનમાં સુધ્યથાતિ જળવાઈ રૂઢ એ માટે ખાંધ્યીની રકમ નિશ્ચિત કરી "બેંકર સેટલમેન્ટ" નામે આગળાતા કરાર સૌરાષ્ટ્રનાં રાજ્યો. સાથે ક્ર્યા અને સૌરાષ્ટ્રમાં ગાયકવાના પ્રતિનિધિ તરીકે વિદ્ધબારાવ હેવાજુને મુક્યો, આ કરારના અમલ પાછ ધામે ધામે સૌરાષ્ટ્રમાં શાંતિ પ્રસરતી જતી હતી, અપદાર્થ શાસન ધામે ધામે સ્વધારું જતું હતું, વિદ્ધબારાવ ગાયકવાડી પ્રદેશનો સૌરાષ્ટ્રમાં વિસ્તાર વધાર્યે જતો હતો.

વિ.સ. ૧૮૯૮ માં જૂનાગઢના રાજ્યાંત્ર્યમાં જરૂરી ખટપણે ચાલુ હતી. એ અરસામાં અંગેજ અવિકારી કન્દોક, મંગદર શાસ્ત્રી, વિદ્ધબારાવ દીવાન તથા ચુંધ હેઠાલચિંહરાવ ગાયકવાડ જામનગર પર સરારી લઈ ગયા. આ અધા સાથે દીવાન રચુનથાળ તથા રચુણેણું સરોરે મેળ હતો તેથી રાજ્યાના કેટલાક અમદવારોએ નવાય તથા એની માતાને અભેરણી કરી અને નવાયે દીવાન આઈજાની સલાહોની ઉપેક્ષા કરવા માંદી. આ તકનો બાલ લઈ દીવાન વિદ્ધબારાવ જમાદાર ઉમર અને નવાયાના ખાંતિ સંબંધમાંને ઇનામની દાખલ "આપી ગાયકવાડ સરકારને નામે નવાય હામિદખાન-પાસેથી અમરેલી અને ડોડીનારાના પરખણું લખતી લાંધાં તથા ધારે ધારે જીબ તાલુકાઓ પણ ગાયકવાના રાજ્યમાં મેળવી દીધા.

ત્યારાદ વિદ્ધબારાવના પ્રયાસથી સૌરાષ્ટ્રમાં ગાયકવાડનો પ્રદેશવિસ્તાર ખૂલ થયો આ અગાઉ દીવાન અમરણુના સમયમાં ગાયકવાડના સ્થાન કુલ ૧૧ શામરાવે અમરેલી કાંગે કરી તો ગાયકવાડી થાલું રાખેલું. અભર મગતાં જ અમરણ લખકર લઈ અમરેલી પર ચરચા અને જીવાળને શરણે આવવા કરાજ પાડી. આ પ્રસંગે પરાજિત શત્રુ પ્રત્યે અમરણને એટાં બધાં નાગરી નિવેદ અને આનદોની દર્શાવાં કે ગાયકવાડી સત્તા કાયમ માટે અમરણ અને એના વંશનેની મિત્ર બધી ગઈ, નવાય હામિદખાને અમરણુની હત્યા કરવી તેવા ગાયકવાડી સત્તા એટાં બધી ઉરકેરાઈ ગયેલી કે નવાયી નાખૂંક કરવા સુંદરીની નોંધન અણ. જે અમરણુના પુત્રો નદ્યનથળ અને રચુણેણું અથી

नवाखी दीवानगरी न संभाला होता तो जूतागदो इतिहास कंठक मुहुरे ०८ लभात । आज
आखिरा नवामे इरीथा रण्युछोड़कनी स्वाहाहे अवगति अने अमरेला तथा कृतीनार परगणी ५.४८
माटे गायकवाडे गया।

आ उपर्युक्त गायकवाडी सूभा विकल्पराव देवाळमे १८ भी सहीना आरंभामा सौराष्ट्रमां गायक-
वाडी सत्ता अने प्रदेश विस्तारवारी क्षमगीरी दाढ़ थरी, ऐसे आशाना क्षाहीओ करे भीजों
पासेथी गामे लाघी लाई २६ गामोंने 'हामतगर' भद्राव जनायो, इ.स. १८०४ भां भावनगर
रोक्य तथा गवळाना आवर क्षाहीओना संयुक्त तापातु 'शिवानगर' भेज्यु तथा ओला आठ गाम
मेणी 'शिवानगर भहाल' जनायो, राखिंगवाला भद्रावहु करते होते त्यारे विकल्पराव अने
धारीना डिलो ६८ लाधी, इ.स. १८०६-०७ भां धारीना संविद्याना क्षाहीओं १३ गामीनी गणीर
गायकवाडे लभी आधी, १८११-१२ भां लभालिंगी नों। आणो भरास च.च.ठीना क्षाहीजाचे लभी
आप्यो, आ ७ असरामां भांतरवड परगणाना क्षाहीओं १४ गाम गायकवाडे आप्यां, ए पटी
सरसिया च.च.ठी अने भांतरवडने धारी तालुकां समावी लाई, गेवधुर तालुकांनी तर गाम पशु
धारी साचे लेठा दांधा, वाणा क्षाहीओंचे चवाळा अने ओला २८ गामीनी नवीर नानानगरना जनमने
त्या गीरी मुहुरी होते गोरे-हळ्यु विकल्परावे जम पासेही अर्दीही कर्त चवाळाने धारी भहालामां
जेडी हाहुऱ, विकल्पराव देवाळमे इ.स. १८२० सुधी गेठें दाढे दुशगतापूर्वक वर्द्धावट चवाळायो,
ऐसे अमरेलीमां सुख्यमयक दण्ड्यु दहुऱ.

इ.स. १८०४ भां भावनगरना गोल पर्यातिंहुलमे गायकवाडी दीवान आपाळु आपाळु ने
अंडांची आप्या एन्कार कोरे, परिवामे कुळ थतां भावनगरनी खूप खुारी थई, आपरे समाधान
करी वर्पतिंहुलमे अंडांची आधी, इ.स. १८०७-०८ भां वडोदराना शेसिडन्ट कर्तव योकरे ग.य.क-
वाड वती सौराष्ट्रन राज्यांमे साचे करार कर्ता तेमा भावनगरने समावेश थई गयो,

आ वधा समय हरभ्यान ६७ आपामंडळ वावेशे ॥ १८ कामानं स्वतंत्र हहु, वावेशीना लौही
अने क्षात्रतेज लाशीतां हाता, दरियापाराना देशामी पशु अमीनी नौदिवाकितीनी नाकना हता, परेष्युमे वावेशी
कर जनवा दाग्या, शारूद्वना दिकरा सामैयाना वडोणा, हुंडुंना मृगु सांगे, पांचे अन वेसी
माशेकिना मैद भाता नहाता, वेवामां इ.स. १८०४ भां इस्ट इनिया कृमपातुं अंक वडालु वावेशीमे
दूंट्यु अने प्रवासीमे पर फुमोया कोरे, जेमां एक अंकेच हंपतीनी पशु हत्या थई, मुंगुर्हीवा
अंकेच नीक्षारौन्य आप्यु, पशु दारकाना दरियानी तासीरीची अगलेहु आ सैन्य वावेशी सामे हारी,
हताश थई पाहुऱ हहु, आधी तो सामैया आणेको उन्माद वधेये अने वावेशी गेताने हरियाना राज
गेवुवा लाग्या, इस्ट इनिया कृमपाती तुकसानी अरी आप्या वावेशीने लप्तु, पशु वावेशी
दाह न दीधा, छेटे कृमपाती सरकारना हुक्मीनी वडोदराना शेसिडन्ट कर्तव योकरे, काढियावाडना दीवान
विकल्पराव वज्रेर वडोदराना मेटा सैन्य साचे दारका आयवा अने वावेशी भरागेने भेवाळा कृमपाती
नुःस नी अरी आप्या अने करार करवा समलग्या, वावेशी सरदार मृगु नाशेक मृगु लकरे जेई
अनी सामे चवाळु येवन न ज्याती समय पारभी करार करवा सङ्करत थवा, ऐसे एक लाख दस हजार
हप्यानो ६३ अरपातु न्यूव कर्तुऱ, वावेशी सददारो आवडो मिठो ६३ आधी राक्या नाडी, योकरे चूप
रक्षी अने इ.स. १८०७ मां गट आव लाव हरक, धीर्घाडा अने पोतियाना तालुक्हरो साचे करार थवा,
(मा करारनुं शुभराती आपांतर श्री अग्रवालानां संपत्तामे इरेक्ष ले तेनी नक्कल आरी नोंदपोथामा
में उतारेव छे, पशु विस्तारवाये अरी २९ करेव नथा.)

आ क्र०१२में ऐटना कुंतर गोपकनी महोर अने राणा क्षगराज का० २८३ छे, दुस बार इकमे छे, ४२५पनी वटी आर्चिलाल रोल्टर्सननी सही छे, भिति भागसर सुर्व १५, संवत १८६४, ता. १४ रिसेम्बर, १८०७ छे, आंड नंबर : १४ बाले ऐट अने द्वारकाना तालुक्हार माटे कृष्णा राव राखधण्ड जामीन थया छे अने गेना हीवान डंसराज शाङे सही करी छे, आनी नक्क फैपनीने खीनी सुन्दरु अपथ आरहत गोपीचाउवामां आनी, आम छाँदा वायेशी आ कराने न पाएवा अने अमेनी तोइन आलु रखा तेथे भादामुसीपते छे, स. १८१४ अं अमेनी पासेथी रा. ऐक लाल दस फैलरना दृळी रुक्म वसुक उत्तवामां आनी, आथी तो वायेगे वधु तोक्हने चयत्ता ऐवटे छे, स. १८१६ अं कृष्ण ईस्टनी २३ः३१ नंचे ६ रुम मेडु लक्ष्मर आव्यु, गायकवाडी सैन्य सलायामां २३ीने कृष्ण ईस्टने भद्र कृतु रुहु, आ वापते नमनगरमा जम सताळ अने जम रथभल वर्चये गाहीझो दुमुक विवाह चालतो होतो अने गायकवाडी दीवाने आने लाक उहावाना सवाया लक्ष्मर साथे आवश्यी नाखी हुती, आ लगाईमां वायेशी दावी न शक्ता, आनी सरकारे पौद्वाराना महाराजा आनंदराव गायकवाड स थे करार की, ओआम उगना तालुक्हारी पासे बाजी वेशी तुक्कानीनी रुक्म तथा आ ऐक्ली लगाईमा अर्द्ध गायकवाड पासेथा वसुक ईरी ओआम उगना प्रदेश गायकवारने ता, १११-१८१७ ना रोज सुपत झोरी, आम ओआमां पाल गायकवाडी कला प्रसीद गर्छे.

आ करादनी दोंच घण्य विस्तारलये ईरी नथी, आ हारेथी स्वमानी वायेशीनु अंतर धाव्यु, प्रामाल आणुके अंड ज्ञाव्यु, धर्यां नाम ऐशनमेहान थाठ गया, केटन कैरीक गायकवाडने भद्र कर्ग हेड्वाने मेहायो, आथी वायेशी वधु दगे चयत्ता, हेड्वाने ओआमां रुहु लारे पर्यु अने पौराणक तरह नासी गयो, आथी गायकवाड अ.रे चिंतामां मुकाई गया, ऐवटे ता. ११-१२-१८२० ना रोज दृक्ष्य रेट होपते द्वारकाना दिल्ली तोडा अने जेते प्रकारे वायेशीने कृष्णे करवा हुक्म थयो, भीष्म युद्ध थयु; वधा वायेशी भराया अने कृष्म पक्षगाया; रोणा संगरामाने पथ्य कृष्म पक्षगाया, आ युक्तमा० ८-१२-१८२० ना रोज केटन भैरवित नामना शुक्वाने अभूव शैर भतावी पोतानो लन आणो जेतो प्रश्नस्तावेअ द्वारकामां जेती ईरेप भरे छे.

पाऊणी सरकारे फ्रेड अनानी कैट्स्नाने मुक्त कर्ता, वायेशीने वर्षभिन आधी आधां अने समाधान कृतु, त्याशेही एवीन वर्ष ओआम उगना शाति रदी, ईरी वायेशीये गायकवाडनी धोसरीभायी नीक्की अवा संवत १८१३ ना भद्र सुहि वीजे वसर्त मुक्तमे बेगा भणी पाच हराव इयो, जेवा गायकवाडना महेनाने उगनामां राखवतो अने जेते कृष्मी आनी माहिती भेणवानो द्वारव पक्ष होते, पक्षी जेवा भाज्जे, सुआमाल आव्यु वायेशी पक्ष करावे कर्त्ता छाँदा गायकवाडी अभवारोने द्वारकाना वडीवटमां सळजाना न गयो, सुवर्त अंम्बद्युद्धी तीनी.

जन्मुआरी, १८४८ अं द्वारकावेलमां वायेशीने अथवा भूतो अने गायकवाडनी धोसरी ईगारी द्वावाने छेद्वाले भरणियो, प्रयास कीरी, कृष्ण डोनावन ज्ञाव्यु लक्ष्मर शर्ती आव्यो, ता. ३-१०-१८५६, अंग्रेज शैत्यनी तोपनी जेवाने एव वापते लोड्कावामां “अपमाण्य” कडेवाता, अनानी हृद्वे, थयो, अंग्रेज शैत्यने संविधि गाटे कृष्म भेड्वायु, ज्ञानाम भूतो :

“ शेठ असी, राठीराडल पुतर नैवूँ;
अभूतो वेदवी द्वारकानाथ आप;
टापीआरान्ने हि ईरी व्यो आप.”

धैरने द्वारा अंग्रेज सैन्ये काले डेर वतविंशी, भेटना भवित्वे अने किल्सों लुड़ी खोलायो, पर्यावरणीयों गयेनी कलब की, डॉक्टरोंने पथ भारी नाभी, भेटना भवित्वेन होवत लूटी. औक्टोबर, १८५८ मां भेटना भवित्वे तून्ही ते गायकवाड सरकारे ता. १८-३-१८६१ सुधीमांडी भाघांया. ऐ अजेना एक घर पथ छे. त्याक्षात् भुग्यु भाष्येक अने जेवा भाष्येक बहारवत यड्या. पर्यावरणीय परंपरा आवी. आधरे वडोदरा राज्यना गायकवाडी काठियावाडना हीवान, राज्योंतना प्राविटिक्स ऑफिन्ट, अभरेलीना गायकवाडना अभमूदार, ज्ञापना इसिंग्नट सौम्ये भणी श्रोआनु तंत्र असग जोडववा निष्कृत अर्थे सत्ता गायकवाडवाडनी रडी. आम भारत स्वतंत्र यत्ता सुधी सौराष्ट्रा धूषा मोटा भाग पर गायकवाडी सत्ता रडी. जेके ज्ञापनांगनी सत्ता लारे परी गर्छ अता राज्योंना विदीनीहरण सुधी गायकवाडी सोराष्ट्रा उपर वर्षदिवा पोताना तमाम प्रदेशोंमा सत्ता भगवी राखी अने अंते ई. स. १८६४ मां भारतसंघांमा विदीनीकरण थसु;

३. वामक्षणा भविर वासे, वंथजी सोरक-२३२६१०

संहार्य था ॥

- (१) शुभरातनो राज्याय अने सांस्कृतिक धितिहास : डॉ. शिवप्रसाद राजगोपा
- (२) शुभरातनो राज्याय अने सांस्कृतिक धितिहास : श्री रसिकवाल परीभ तथा श्री हरिप्रसाद शाळी
- (३) तवारीजे सोरक व हालार : अनु. श्री शंखप्रसाद हरप्रसाद हेठाई
- (४) तवारीजे सोरक : हीवान रथाण्डेण
- (५) प्रकास अने सोमनाथ ; श्री शंखप्रसाद हरप्रसाद हेसाई
- (६) श्री अभावंगना वावेर : श्री कल्याणगाय नेशा

आ उपरांत हैनिडा, भासिडा, विविध वर्तमानपत्रों अने सामयिकी.*
* शूभराष्ट्र-२३२६१ धितिहास परिपूर्ण-ज्ञाना अधिवेशनमां व चायेल निर्मांव, डॉ. डेववाल कामतार गोप्य चंद्रक-विजेता.

स्थापना : ता. ११-१०-२७

हीन : ५५३२६१/५५८३५०

धी अरोडा सीटी को-ऑपरेटिव लैन्क, लि.

रजि. ऑफिस : संस्थावसाहून, रावभुरा, वडोदरा-३६०००१

शाखाओ : १. सरदारसवन, ज्युभिली भाग वासे, डॉ. नं. ५४१८२४

२. भृथरगेट वासे, डॉ. नं. ५४१६३१

३. इतेगंज, चयंगी सामे, डॉ. नं. ३२६३१४

४. सरदार आग्रालय, कारेलीभाग, डॉ. नं. ५४८१२

५. गोरवा शाखा, जडातनाका वासे, वडोदरा, डॉ. नं. ३२८३४६

हेरै प्रभारनुं जेनिंग कामठाज झरवामां आवे छे.

मनेश्वर : कांतिकार्य डी. पटेल मंत्री : व्याङ्कंतकार्य श्र. पटेल

प्रभुभ : कीकार्यार्थ पटेल

स.टेलर/१६६१

पथिक

सौराष्ट्रनां वनस्पति-आधारित गाम-नामे।

[गतोक्त्या चालु]

ज्ञानगढ़

जिज्ञासा-भीज्ञावाणुं गाम

लंगुडा-मूण (सं.), जग्मुदानक

लंगु-लंगुडानां वृक्षवाणुं

पीपरटोडा-टोडा नामनी व्यक्तिए वसावेहुं पीपरवाणुं

पीपणी-पीपणीतुं लधुरूप पीपणी-पीपणावाणुं

वरपांचसरा-पांच ताळाव(सर)ना कठि

आवेल वडवावाणुं

आंभरी-ज्ञान, ज्ञान आपुतुं आंभावाणुं

“ उरी, उरी-हेरावाणुं ”

“ भूपत, भूपततुं ”

“ मेधपर, मेधाज्ञतुं ”

“ मेवासा ”

अदी “ दी ” प्रत्यय आंभातुं लधुरूप संचये छ.

नागिरी-नागिरीना वृक्षवाणुं

वायवा-रायवाणुं

आंभक्षिया-आंभक्षीवाणुं

रावज्ञोनेश-रावज्ञा(लंगुडी एक ज्ञान)वाणो नेश

कटोविया-कटोवाना वेला ज्ञानां पुष्टण प्रभाषणां

थाय छे तेवुं

गूंदा-गूंदाना वृक्षवाणुं

हायवा-हायक्षिया वेरवाणुं

आभरण-आभराना वृक्षवाणुं

पूतूरिया-धूतूरावाणुं

आभक्षा-आंभक्षीवाणुं-नाना/मेटा

अभूरिया-अभूरीवाणुं

पिपरिया-पीपरवाणुं

बींगुडा-बींबटीवाणुं

आभरा-आभरावाणुं

आभरिया-भाडु „

“ -वर्जर वर्जरतुं आभरावाणुं ”

जिज्ञासा-नपाखिया-भीज्ञावाणुं पास्ती वर्गरतुं के

ओआ वाणीवाणुं

पर्शिक

श्री. हुसमुभक्तार्थ व्यास

जिज्ञासा-ज्ञानत-ज्ञानतुं भीज्ञावाणुं

“ भावाभी-भावाज्ञतुं ”

काकमेवडा-काकमेवनामी वनस्पति ज्ञानी थाय छे.

दादर-ज्ञान, दादर ज्ञानी थाय छे, दादर ए ऐथी नथ्य

हाय जांचो छेइ छे. अने झार्णा सहेद रुख

आवे छे. जेता भीज्ञावाणी खालगो. रस

दींगु साथे दादर पर योपडवामी आवे छे.

कुवाडिया-कुवाडियाना छोइ ज्ञानी थाय छे. आ छोइ

सामान्यतः पडतर ज्ञानी उपर योटा प्र-

भाष्यामा जिगी निक्को छे. औषध तरीके धर्मो

उपयोगी छे. (2) कुवाडिया शाखाना आही-

शेअरे वसेवेल

कृपुडी कृपुड-कृपुरियावाणुं. कृपुरिया एक धर्मी

शाखायोवाणो. छोइ छे. आमांथी कृपुर केनी

सुगंध निक्काती होई अने कृपुरियो ठडे छे.

दुष्टता दांत के दाढ आटे आना. मूर्खातुं

दातणु करवायी राफत भेले छे. आ छोइनां

पान आधाशाशी आटे पथ उपयोगी छे.

जूलागढ

आंभलिया-आंभलीवाणुं

लंगुडी/लंगुडा-लंगुडवाणुं गाम

पिपलिया-नवा, पीपणीवाणुं

“ तडका (?) ”

“ ‘हुमणी’, नामनी व्यक्ति के शाखाये वसेवेल पीपणीवाणुं ”

पिपलवा-पीपलावाणुं

पिपलाखा-,, (मु) पीपलानक

पीपणी-भडु/सारङ्ग, पीपणीवाणुं

पिपरडा-पीपरवाणुं

पिपरडी-टीभें, पीपरवाणो टीभें

मांगनाथ पीपणी-मांगनाथ

मङडेव पासे जिजेला पीपणीवाणुं

दींगीधार-दींगंगतुं ओविंग दींगी-

संस्कृत/१६६१

२१

नानी-पातणा लोभदावाणी धार
आंध्रां-अभिवागु
पिजडिया-भीजडावागु
गूंडियाणी-गूंडीवागु गाम/नानी गूंडीने
केटगूंडी पथु कहे छे, ऐनां इन भीडां हेय छे.
आंभिकाश-आंभिवागु
करमहडी-करमहीवागु' गाम, करमहानां वृक्ष वार्ड
धेधूर ने नीचा हेय छे. सिंह ऐती छायानो
उपयोग ४२ छे.
आभरावाळा-आभरावागु
गित्रावड-गित्रानामनी व्यक्तिअ वसावेलुं वडवागु
जनवत्था-'जन' ए शाई अरीतुं नाम छे. अबे
वसावेल वल्लावागु' गाम, देरी' गाम पथु
'जन'शाईनी देरी' तरीके ऐगभाय छे,
ए अभरेवी नित्खामां छे.
प्राप्तवड-ल्लादार वडवागु
आभरवड-
वडवाणा-वडवागु
पाटवड-उपरथी पाट-स्पाट लेवा लागता वडवागु
वांदरवड-ज्यां वांदरा रहे ते वडवागु
मांडावड-'मांडा' नामनी व्यक्तिअ वसावेलुं वडवागु
नामवत्था-ज्यां नाम रहे छे तेवा वल्लावागु
क्षालावड-क्षालाक्षाअ वसावेलुं वडवागु' गाम अथवा
अक्षम लीलाश यर्ह ज्ञान-उक्तामा दूरथी
जे वड आगो देखाय छे तेनी नक्षक्तुं गाम,
'इत्यावट'
ज्ञेत्रवड-ज्ञेत्रवाल नामनी व्यक्तिअ वसावेलुं वड-
वागु' गाम अथवा ऐती स्मृतिमां वसेलुं
वडवागु
भीरवड-झाई भीरना स्थानक्षणा वडवागु
वीछावड-वीछां-भिछ (आ नाम काढी शातिमां हेय
छे) नामनी व्यक्तिअ वसावेलुं वडवागु
सुडावड-ज्यां धथा सुडा-पैपट रहे छे तेवुं वडवागु
आंभावड-ज्यां धामे अने वड अक्ष साथे जिगेल
छे तेवुं

भीलावड-भेक्तन भीला ज्ञेम जिभा वडवागु
आंभेवड-

कुंडवडी-कुंडवटा ज्ञेवा वडवागु
वडवी-वड'नी लघु आडूति वडवीवागु
ऐराडी-ज्यां पुष्टग ऐ-री थाय छे
भीलडी-भीलीवागु. शीही पवित्र वृक्ष मनाय छे.
ऐनां पान शिवने चगवाय छे. आ वृक्ष अडु
अट्ट स-ज्यामा ज्ञेवा भगे छे.
कुल्ली-क्षेत्रवागु
क्षेत्रआ-ज्यां क्षेत्रे थाय छे तेवुं
क्षेत्रज्जी-क्षेत्रज्जी वृक्ष सीतुं जीतुं हेय छे. ऐना
गूंड-मान-भी-भूग वगेरे औषध तरीके
वपराय छे.
मराणा-आरावागु' उमराना भूग अने अल औषध
तरीके वपराय छे.
उंभरी-ज्यां जिभरा-उंभरीतुं वृक्ष छे. जैत्र दान-
शासनां तामपनोआ 'उदुम्बु' गाम
नाम अगे छे. जिभरा-उंभराने संस्कृतानां
'उदुम्बर' कहे छे, ए औषध भाटे पथु
उपयोगी वृक्ष छे.
उंभतिया-भजूरी. उभत नामनी व्यक्तिअ वसावेलुं
भजूरीवागु
,,-आभरा...आभरा ज्ञेत्र छे ते.
नरका-आ ऐक विशिष्ट गामनाम छे. नड अर्थात्
'नेतर': ऐक्टे के ज्यां नड-नेतर थाय छे.
महुडा-ज्यां महुडा थाय छे
महुडी-महुडो रु नशाक्षारक छे.
भजूरी-भजूरीवागु
आभरावाणी-आभरावागु
थेरी-थेरावागु: 'थेरी' ए ऐक जातनो पथर
पथ थाय छे. संभवतः थेर लेवा भीक्षा
रंभानी ने घेच्या होवाथी अने 'थेरी'
इत्थो हेय.
कांक्षियाणा-कांक्षिया नामना कांटाणा लेवा ज्यां
थाय छे.
बडु-गडु अर्थात् गणा. (स.) गुड्यां वाड के वृक्ष-
आधारित वस्थी उपयोगी वनस्पति छे.

ભાવનગરે

ગુંડાગા-ગુંડાવાળું

ગૂરી-ગૂરીવાળું

થોડી-થોડીવાળું કે આ નામના પથ્યર જ્યાં મળે છે.
ભૂંભૂ-ભૂંભૂલા, ભૂંભૂલી એ થોરની એક જાત છે.

આવ થોડીવાળું

અડસલી-અડસલીવાળું: અડસલીને દેશી ભાષામાં

'પિતપાપડો' પથ્ય કહે છે. સામાન્ય રીતે
વધીઝિતુમાં પુફળ ગ્રમાખુમાં જીવે છે,
પાન વાંચા, ઇલ ચુંબાણી કે જાંખુરિંા.
આની ભાજુ પિત-કૃષ્ણ મટડે છે.

પાંચપોળા-પાચ પોળાવાળું

થોરડી-થોરડીવાળું

કરમદિયા-કરમદિનો વૃક્ષવાળું

નાલુગા-નાલુગાવાળું

પિપરડી-પી-રવાળું

થોરગા-થોરવાળું

પિપરગી-પીપરવાળું

પિપળા-રીપળાવાળું

ભાષુરડ-ભાષુર નામની વ્યક્તિએ વસાને વડવાળું

ધીવારલી-ધીપા નામની વ્યક્તિનું વરલીવાળું

ભાભાવડ-ભાભા " " "

ખિજિયા (નેથથુવદર)-ખીજયવાળું

નોથથળએ વસાનેલ

" મોખડા, મોખડાએ વસાનેલ

અંકિયા-અંકિયવાળું

અંકોલડા-અંકોલ-અંકોલ નામના વૃક્ષવાળું. આ

વૃક્ષનાં ભાલ અને ભૂળ દવા તરીકે વધસ્ય

છે. એતું ભૂળ રેખે છે. કણ એક શીવાળું

ને ખટકુદું હોય છે.

લીંઅડી-લીંઅગવાળું

પીપળી-પીપળ, પીપળાવાળું, પીપળાને

સંસ્કૃતમાં 'પિપળ' કહે છે.

રામપોળા-પોપળાવાળું રાજશ્રુત

અંબળા-અંબળાવાળું

લાંપાળિયા-નાંબાં લાંપદ વાસ પુષ્ટા થાય છે.

પથિક

અમૃતવેલ-અમરવેલ, (સ.) અમરવરલી. આંધાના

વૃક્ષ પાસે આ વેલ જીવે છે અને એનાં ભૂળ

આંધાના વૃક્ષમાં જ હોય છે. આગે રવાદ

તીઓ મિશ્ર હોય છે. આંધાના રોગ તેમજ

કરે પિત ને આમનો નાશ કરે છે.

નાવંની-(સ.) નાયપત્રી. ભૂળ તો નાયદળની ભાલને

'નાવંત્રી' કહે છે. નાયદળ (સ.) જાતીદળ

ભારત અહારનું વૃક્ષ છે. ગંગાની તીખો કણી,

મુખને સ્વચ્છ કરનાર છે. કરે રકાદેખ

ઉધરસ જીવી અને વાસુ તથા દૃષ્ટિની નાશન

છે. આ નાવંની-નાયદળનું વૃક્ષ જ્યાં છે.

સામાન્ય રીતે નાયદળનાં વૃક્ષ સૌસાંધુમાં

થાંન નથી જ્યાં કંચાંક થાય તો એને ઇન્દ્ર

-નાયદળ આદતાં નથી.

અરાગા-અરાવાળું અરો (સ.) દમનક ડમરાનો

છોડ ૧-૨ કૂટ વધે છે. એની વાસ તીવ્ય

હોય છે, દૂર્થી જ અખર ગરી જાય છે. આ

છોડની આસપાસ ચાય આવતો ન હોઈ

થથા ધર પાસે કે કણીમાં વાવે છે. એ

ઓપ્પાંખ તરીકે પથ ઉપયોગી છે.

સાજકોઠ

કુવાડવા-કુવાડિયા (૧) કુવાડિયાના છોડવાળું ગામ.

આ છોડ ચોમાસાંના જડુઘથી જીવે છે.

એક જાતનું જંગલી શાક છે. જે નથ્ય-

નથ્ય કૂટ જાચો થાય છે. આની ભાજુ

ખવાય છે. વાયુ પિત ઉધરસ પગેરે માટે

એ ઉપયોગી છે.

(૨) કાવાડિયા શા આના આહીરોમે

વસાનેલ જામ

ખિજિયા-ખીજયવાળું ગામ

ખિજિયાગોડ-ખીજગાવાળું જાતું ગામ

ખિજિયા-નાના-મેટા

ગુંડા-ગુંડાવાળું ગામ

થોરગા-થોરવાલા-થોરવાળા-થોરાળા થોરવાળું

પિપળિયા-પીપળાવાળું

પિપળિયા-પરા

पिपणिया-करमाण, करमाण नहीना होठे वसेलुं
भीपणावाणु

पिपणिया जूता- अर्थ २५८८ हो.

पांचपीपणा -पांच भीपणाना समृद्धवाणु

पिपणवा-आवा

” बोडा-बोडा (चारख) नाभनी कोठ
व्यक्तिमे वसावेलुं भीपणावाणु

पिपणिया साल. साल (भूग सालेह) नाभनी व्यक्तिमे
अे वसावेलुं भीपणावाणु

” सोम. सोभलुओ वसावेल ” ”
” ग्रेज-री. आ ग्रेज ग्रेजसीतुं भीपणावाणु

” मालशुली. मालशुलाईतुं

” होठी. होठा पासे आवेलुं भीपणावाणु

” नगर. नगरसरतुं भीपणावाणु

नांदु-नेंदु-पिपणिया. नेंदुष्ट नाभनी व्यक्तिमे
वसावेलुं भीपणावाणु

पिपणिया-पाण. नया पाण-धधु विलुं रहेतुं होय
तेवुं भीपणावाणु

पिपणिया-राज. राजकोटतुं ” ”
भीपणी-भीपणाणुं लधु ३५ भीपणी नया हो.

पिपवाणु-भूत भीपवाणक. भीपणवाणु
वैरडी-वैरवाणु अथवा वैरडी प्राचरना पद्धर जयां
भणी आवे हो.

आर्थियाणा-आर्थियावाणु

जूंदाणा-जूंदावाणु

जूंदासरी- ” ”

भीली-भीलिना वृक्षवाणु

अविद्याणा

दणिया-दणियावाणु. दणिया नाभनो होउ थाय हो.

घोराणा-घोरवाला-घोरवाणा घोराणा घोरवाणु

लंखुडी-लंखुवाणु

भूंडाण-भूंड नाभतुं धास जयां भूंड थाय हो.

गजरीहड-भूत गजरीहड. आ डोड वर्षी गजतुमां

विशेषत जोगे हो. आना डोड नीचे ४८ होय

हो. जे त्री होय हो, पथ आनां झूळ
महादेव-जौरीने चडता होइ 'गजरीहड'
नाम पहुंच होय एम लाजे हो. आनां
पानरो रस गरम करी, तेक भेणवी हुभता
कानमां दीपा तरीड वपराय हो.

काणापाट-(१) काणापाटना वेला होय हो. जेनां
भूत-पानरो रस औषध तरीड वपराय हो.

(२) भूत बांडु भासी होवनया काणा लागती
सपारीवाणी पाट पासेतुं जाम

कटोबिया-कटोबा (कटोडा) जया थाय हो. सामान्य
रीते कटोबीना वेला चोभासामा सीभमां
थाय हो, रोडे वाडनी ज्ञाये पदे हो. लोला
लीक्का रंगना कटोबा इणा आवे हो, जेतुं
आक घनावय हो. कटोबी वसु क्षे पिता
पजेरेनो नाश करे हो.

उडियाणा-डोडी नाभनी वनस्पति जया थाय हो.
‘डोडी’नां इनने ‘भरभोडी’ कडे हो.

जोरडी समठियाणा-जोरडीवाणुं समठियाणा

रायझु-रायझुतुं जक्क जया आवेल हो.

धूधराणा-सीभमां अडुआउ गाथे जेवा दृक्ष ४ झूट
जांचा एक जतना छोड थाय हो. संस्कृतमां
आने ‘शुद्धवृद्धिका’ होहे हो, केवडे एनी शींग
मुकाय त्यारे धूधराणी ज्ञेम वागे हो माटे आ
छाउने ‘धूधरो’ पधु होहे हो. आम, धूधरा-
वाणुं

चरेल-‘चरेल’ नाभतुं जक्क थाय हो. ए धधुं जिसुं
पदे हो. पान ३ थी ६ ठिचना कांगोगी
होय हो. दृक्ष सङ्कें के लाल रंगना, इणा
पोणा रंगना चपरा पातला चक्रडां जेवा.
आतुं लाकडे सार जेवुं होय हो. आ वृक्ष
जयां हो तेवुं जाम ते चरेल. आ पटाहि
वर्गतुं दृक्ष हो. भूत संस्कृत नाम ‘चिर-
मित्र’ पक्ष सौराष्ट्र भां आने ‘चरेल’ होहे हो.

उत्र हिंदुस्तानभां आने ‘पापडी’ होहे हो.
अरस्थी-अरस्थीवाणु. आ वृक्षनी एने जत हो : नानी-
मोडी अथवा घोणी-झणी, नानी अरस्थी प-

पडी

૧ કુદ અને મોટી બેનાથી બણ્ણી વધારે
જોંગી થાય છે. કુલ સુમધૂમી હોય છે. મોટી
અરણીનાં ભૂત છાલ વજેરે ઔપિષઠ તરીકે
વપરાય છે.

દંશરા-અરણીને કચ્છી ભાષામાં 'ટાંકારો' કહે છે.
સંભવત: આ 'ટાંકારો' પરથી 'ટાંકારો' નામ
પહુંચું હોય. અસ્થળતા, આ એક સંભાવના
માત્ર છે.

ઉપદેશ-'ઉપદેશ' નામની વનરપતિ થાય છે તેના
પરથી (?) મૈન્ડકાલીનાં દનાશાસનેમાં
'ઉપદલેટ' નામનો આગોદ્દેખ મળે છે.
(સંદર્ભ ડૉ. કશિમસાદ થાણી, 'મૈન્ડકાલીન
શુજરાત' ભા.૨, પરિસીષ્ટ ૫, પૃ. ૪૫)

અભૂતા-અભૂતીવાળું

નાજિયેરી-નાજિયેરીવાળું

નિપરદી-પીપરવાળું

થેરી-થેરવા, થેરવાળું

આંકડિયા-આંકડા (સે-આંકડ)વાળું

આખરા-આખરવાળું

ઓગપોર-ઓગા નામની વ્યક્તિએ વસાવેલું
પીપરવાળું

થેરિયાળી-થેરિય થેરવાળું

આખરણા-આખરવાલા-આખરવાળા-

-આખરગા આખરવાળું

પોહુડી-પોહુ જનરવાળું

આખરેચી-આખરવાળું

અશુદ્ધિયા-અશુદ્ધવાળું

અનેસિયાળી-નાયી કંબસા થાય છે.

તરવડા-તરવટા:-તરવડા-નષ્ટ વડના સમૂહવાળું

અભુતા-અભાગ મોટા વડવાળું

અમનાનર-અમના નામની સત્રીય ઓળખાતા
વડવાળું

શુતવડ-નષ્ટાં ભૂતનો વાસ મનાયો હોય તેવા નડવાળું

ભાનુવડ-પાંચ વડસાન સમૂહવાળું

બાંયવડ-બાંચ, આંચાળ નામની વ્યક્તિએ વસાવેલું

પણિકુ

વડવાળું' આંચોળ-રાજપૂત ગ્રાતિમાં

નામ મળે છે

બાખલવડ-'બાખલ' શંદ હિંદી છે તેનો અર્થ

ટેલલાઠ બરો અને એકઢાળિયાળી જગ્યા

કરે છે. આ પરથી 'બાખલવડ' એટલે

એવો ઘેંધૂ વડ કે જેનો બધામાં ધર વસી

શક્તાં હોય. આવા વડવાળું'

ચિનાવડ-ચિનાળાં વસાવેલું વડવાળું'

માત્રાવડ-માત્રાશુદ્ધ

મેદાવડ-મેદા નામની વ્યક્તિએ,,

મેટાવડ-મેટા વડવાળું'

રાજનરળા-રાલ નામની વ્યક્તિથી જોગખાતા
વડવાળું'

નાનાવડ-નાના(આ વ્યક્તિનામ કે)થા ઓળખાતા
વડવાળું' આમ તે

રાલનરળા-રસ, રસાળું. એ નામની રાલવી
વ્યક્તિથી ઓળખાતા વડવાળું'

" .. લાલ નામ સાહેભનું, એ રાલ નામની
વ્યક્તિથી ઓળખાતા વડવાળું' આમ

લાલાઓ-લાલા નામની વ્યક્તિથી ઓળખાતા વડવાળું'
કે લાલાએ વસાવેલું વડવાળું'

માખાવડ-માખાણે વસાવેલું, વડવાળું'

ઓફરડી-ઓફરવાળું'

પલાસ-પલાસ-‘પલાસ’ સંસ્કૃત નામ છે, કે હેઠામાં

‘કેસ્ટો’ તરીકે પ્રખ્યાત છે અથવા ‘આખરો’.

આ કલ સર્વત્ર પણ અથવા પ્રમાણમાં મળે છે.

આખરો-પલાસ સર્વાંગી ઔદ્યોગપ્રેરી છે.

કોઢી-સાધરણ કહું શુજરાત ભરમાં સ્વર્ગ જોવા
મળતું ‘કોઢી’ વક્ષવાળું આમ, આ

કોંડાળું વક્ષ છે. આનો ગૂંઠ સારો થાય છે.

કોલકો-કોલ એટસે એરેડી. પ્રસ્તુત અન્યુવેદાચાર્ય

બાપાલાલ વૈદ્ય એસાની સોટી જલ કાશી-

એર માટે કોલ શંદ પ્રયોગે છે. આમ,

યાં આવા કોલ એર થતાં હોય.

બંડી-મૂળી-સુંડી-આના-અધર્થી દેંકે હાથ

ઓચા છેડ થાય છે.

दृश्यानी सुंदर लेवी वांडा पवेली भंजरी
पर एक आळु ऐ बारमां जांछुटी रंगनां
नानां हूँक भोवे छे. आ छैऽ वर्षांतुमां
पुष्टग जिं छे. पीछीना क्षापतुं त्रेर उ-
तारवा पर आळुं भूण उपयोगी छे. आभना
हुभावा पर, गृहमा ५२ तेमज हुङ्काहुं
हृतुं हेरड्या पर पान के अनो रस चेप-
गाय छे.

शेमगा—शेमगाना दृक्षनाणुः। शेमगाने संस्कृतमां
'आद्यमि' कहे छे. आळुं उक्ष औपच आटे
उपयोगी छे. आ वृक्षमां यमनो वास होवाहुं
मनाय छे, आथी अनो 'यमहुम' पायु कहे छे.
तोरखिया—तोरखिया नामतुं धास ल्यां पुष्टग
प्रमाणमां थाय छे ते गाम. आ व.सनां
क्षुसरां तोरखुनी जेम गूथयेव ढोइ अनो
'तोरखिया' कहे छे.

दांक—दांकतुं भूण आचीन नाम 'दंक्तीर्थ' होवाहुं
अने कोई नाथना आपाया दंकाठ द्याई
गयाहुं मनाय छे, पायु पलाश के आधराने
'दांक' पायु कहेवातो होइ ल्यां दांक-आधरा
यता होय तेवुं (?) .

तारण

(१) शोरधुना पांये जित्तानां वनस्पति-आधा-
रित गामनामोओ एक वात २४४८ लघुआई आवे
छे हु आमानो जीटां आग्नां वृक्षो आचीन धार्तिक
अने उपयोगी वृक्षो छे; लेमडे वह पीपर पीपणो
भीजडो. आ वृक्षो उपयोगी तो छे ज, पायु धार्तिक
रीते पायु अनुं भहन्न छे, तो चरेल अरखी दुष्प-
राणा ज्वंती पकाये जेवां अरप संज्यामां भगतां
अने आचां प्रयतित वृक्षो परथी गामनामो परथ
भगे छे. अद्यमत, आरां गाम-नाम अरप संज्यामां
छे. पीपणावाणां पिपणिया लगभग ४०, पिजिया
२१, वड-वडा पर अरप तित लगभग ५० लेट्डा
गाम-नामो भगे छे, अर्थात् वनस्पति पर आधारित
क्षमग गाम-नामोआंगी लगभग ४ था लाग पीपणा
बड्डा ने भोजन परथी छे. पिपणिया-पिजिया

अमरेवी जित्तानो वहु छे, तो राज्ञोटमां वह-
वडा परथी गामनामो विशेष छे. जूनागढ लाव-
नपर अने जमनगर जित्तानोमां विविध वनस्पति
आधारित गाम-नामो सांपडे छे, सौराष्ट्रानां पांये
जित्तानो राज्ञोट जित्तानो वनस्पति-आधारित
गामो सौथी वहु अने विशिष्ट स्वरूपे भगे छे
जलवनी जेवो विशिष्ट वनस्पति के सौराष्ट्रानो
थवानी शक्तता पाल नहिवत छे तेना परथा गाम-
नाम पडे अने एक आश्रय ज्वल आपत गण्डी
शक्त. संभव सुगांध छे, तो जेवो ज्वलनोनी सुगांध
जेवी कोई वनस्पति यती हेय ने अनो आधारे गाम-
नाम अपाहुं हेय. आ १८ आपत उपरिया-क्षपूरी
गामने द्वायु पडे छे; क्षपूर जेवो सुगांध आपती
एक जाती वनस्पति ज्यां थाय छे तेवुं गाम ते
'क्षपूरिया' अने 'क्षपूरी.'

(२) सामान्य रीते यक्षो संभव अतावनार
डोइ प्रत्यय लगाये छे; लेमडे, 'ईया' प्रत्यय 'वाहु'
अर्थ दृश्ये छे, जेवां कै, पिपणिया-पीपणावाणु,
पिजिया-भीजडावाणु, आक्तिया-आक्तिवाणु
द्योरे, तो 'डी' 'या' प्रत्यय तो लघु गामये छे;
लेमडे पिरार्डी भज्जूरडा लाखुडा भोडा

'आश्या' प्रत्यय 'आनक' (सं.) परथा भनेल होइ
अे गाम वहु आचीन होवाहुं मानी शक्त, लेमडे
पिपलाष्टा.

डेल्डांक यक्षोते लघुतावायक 'हा' 'हा' प्रत्यय
लागी गाम-नाम बनेल छे.

(३) व्यक्तिगोनां नामो साये संज्यायेव वृक्षमां
अे नामनी व्यक्तिये वसावेव ने ते यक्ष पासे
अवेल गाम अरथवा अे नामया ओजाभाता वृक्ष-
वाणु गाम जेवो अर्थ लही शक्ताय. ह.त. लाभा-
वड आ लाभा नामनी व्यक्तिये वसावेलुं वडवाणु
गाम के लाभाना वडवाणु गाम.

आम, सौराष्ट्राना वनस्पति-आधारित गाम-
नामोनो आ एक उपराष्ट्रीय परियय भाव छे.
भविधमां वित्तारथा ओं गाल्या अक्षयास बड्डानी
आने एक पूर्वभूमिका गण्डी शक्ताय.

६. हाईरस्कृष्ट, जमक-गरथा-३१०४५०

અમીર નગરીનો ઇક્કીર નેતા

[ઈદુલાબ યાસિને જન્મ થતાણી પ્રસંગે અંગલિ] શ્રી. જિતેંદ્ર નાનાલાલ અંતાણી

મહેનતકસ જનતાના આજુવન સેવક, પેસા માર્ટેની વડીલાત છોડી ક્રેચે રાખું અને પણતોની વડીલાત લીધી, એ ગાંધીજીના 'નવજીવન'ના આચાર સ્થાપક, જેતું 'હિલ બાળક કેટલું' નિર્દેશ, કિયાશીલ છતાં એના કાર્યમાં લશકરી કિરત વર્તોતી, ગુજરાતનું 'ગૌર્જી' એને હૈરે વસેલું, એના અંતરના જીંગાથાં દીન-ઇદ્દિયાનો ઉદ્ઘાર અને રાષ્ટ્રમેવા આદિ શબ્દો કોતાયેલા તેવા એક જનને તા. ૨૨-૨-૧૯૮૨ ના દેણ નિયાદમાં જન્મ થયો. નામ પદ્મું ઈદુલાબ. યાસિક કુલના આ સપુત્રને ગુજરાતે જાણ્યા 'ઈદુલાબ' તરીકે.

ઈદુલાબએ દોકણગૃહિ અથે ઈ.સ. ૧૯૧૫ ના તુલાઈથી 'નવજીવન' માસિક રદ કર્યું હતું. ચાર-પાંચ વર્ષમાં સારી પ્રગતિ થઈ. અ એણું 'નંગ ઈન્દ્રિયા' ગાંધીજી ચચાવતા. 'નવજીવન'ને સાસાહિક તરીકે ચલાવવા ગાંધીજીએ ઈંચા અદ્વિતીય કરી. ૧૯૧૬ માં ઈદુલાબએ એ ગાંધીજીને સોંપ્યું. યાસિક એના ઉપતંત્રી થયા, ૧૯૨૨ માં 'ગુગરભ' માસિક અને બીજા 'કેટલાંક પુસ્તકોત્તુ' પ્રકાશન, સુધીએ પ્રસિદ્ધ થતા હૈનિક હિંદુસ્તાનના પણ તંત્રી રખા. એમણે 'તુમારાં સીરિઝો' વાર્તાઓંથી પણ અદાર પાઠ્યો. સિનેમા મારે પણ વાર્તા લખ્યા. ચિન-નિર્માતા પણ અનતાના રહી રહાતંયકૃતની પરિણારો કાઢી. ૧૯૩૭ થી કિસાનોની પ્રયત્નિમા રસ લેવા લાગ્યા. એમણે 'આલકડા' પણ લખ્યું. સુધીએ સરકારે એને પારિતોષિક આપ્યું. એમણે નારકો પણ લખ્યું છે. શયમણ કૃષ્ણાયી પર પણ એક પુસ્તક લખ્યું છે.

૭૫૦ જ્યા જ્યા ૭૩૨ પદે ત્યાં-ત્યારે ઈદુલાબ વિના વિલંબે પહોંચી જય. એણો કહેતા : "કુઝું માનવી માનવી હું, પગથી પર જીવતો આદમી હું, ગીત વર્ગની જનતાનો માણસ હું."

મહાદેવભાઈ દેસાઈએ એમને 'સૈનિકોના સરદાર' કહ્યા. એ. એમની ડાયરી (પુસ્તક ૬, પાન ૬૭)માં એણો લખે છે : "સૈનિકોના સરદાર ઈદુલાબભાઈ આવ્યા. તેમની ચાકમાં અને સીનામાં તો સૈનિકપણું પહેલાં જેટલું જ છે. જેણે હિપર પણ પોતે પોતાની માનાતી સાઈકલને માંબાની હતી, અને આશ્રમ આગળથી સાઈકલ પર એસિને જ અમદાવાદ આવેલા. સિપાઈ કૂચ ડરતાં હીક ખાઈ હે તેમ જેલમાંથી કૂચ કરતાં એમણે આખરનો નારસો. પણ હીક હીક કરી લીધેલો. તેમનું 'સ્વામત કરવાને મારે પણ સાઈકલ ઉપર આરદ થેલા સૈનિકોનું જ લફ્ટકર હતું. પણ તેમનું કરીર નાખાઈ ગમેલું દાર્યું."

સન ૧૯૨૩ માં ગુજરાતના પ્રસિદ્ધ વિવેચક શ્રી રામનારાયજુ પાટક ઈદુલાબ વિશે આ વચ્ચેનો ઉચ્ચાર્યાં હતાં : "ઈદુલાબ એટલે ? ગુજરાતની જુવાની અને ભરણાની, ઉદારતા અને સરળતા, ગુજરાતના જુવાનેના હુદયર્માં અત્યારે શું આદે છે. એ જાણતું હોય તો ઈદુલાબને જોવા જોઈએ. એ ગુજરાતની છતાં એમનામાં ગુજરાતનું ગણતરિયાપણું નથી અને અત્યારના જુવોનેમાં પણ એ ખંડું એણું છે. ગુજરાતનો જુવાન વર્ષ ભાનપુર્વક પરીક્ષા કર્યો વિના, ઈદુલાબની રહણપદ્ધતિ અને રહણપદ્ધતિની સર્વ રીતકાતોનું અનુકરણકાર્ય હોઈ છે, એટલા બધા એ જુવાન વર્ગને મોદ્દું છે."

ઈંહુલાકાઈ શિખાં ગાંધીજીથી મેળામા હતા. પણ યો રતને પણ છો હતો. દાંડાવા દરમાન ગાંધીજીના ખરપકડ કરાઈ. એ અંગે 'આમાના ભાગ-ઈમાં યાચિક નેથે છે : "પાંચભા મેતા દિવસે સવારના હું મારી ઓફિસનો દાદર અહતો હતો ત્યારે ગાંધીજીના ખરપકડના ઓચિંતા અખર સંકળાને હું ઘણો થઈ ગયો. ઘણો વખતથી ગાંધીજીને હું દીકાઢાર તરીકે પૂજતો હતો, પણ હું તેમની અટકાયતના સમાચાર સંકળાને ઘણો વર્ષથી અંતરમાં જાંડી ખુલાયેલી ગાંધીજીના ઓચિંતા જિબરી આવી. કથાં સુધી મારી અભિગાંધી આવણ અને ભાદરવાં વરસી રદ્દી તે રેખાઓ રોકાય જ નહિ. તરત જ રદુંદિયોતું કામ અંધ હરીને હું ઓફિસમાં વિચાર કરતો એટો એટો.

"મારા સેવાજીનાના પ્રકાતે એ મારા રાખ્યાર હતા. વરસો સુધી તેમના હાથ નીચે તાવીમ વીધી. તેમના પ્રતાપે કેટલી પરિષ્ઠા અરી, કેટલી સંસ્થાઓનો સ્થાપી, સેવાના કેટલાં જાન કર્યાં. સન ૧૯૨૧ સુધી લડતની જણ આઈને જેલમાં ગયા પછી હું કંઈ બાળથું હરીને જેલમાં જતો તેમનો સાથી બન્યો. અધાર નીકળાને મેં તેમના આદર્શ અથવાની અને પ્રેમધર્મની કેટલી તારીદ હરી, અરભાની તેમની નિતિ માફક ન આવતાં હું સુંખું આવ્યો અને "તેમનો દીકાઢાર બન્યો. પણ આવે તો વરસોથી અંતરમાં સાચાંદી જન્યેત પાછી જગ્ઘાનીને તે દેખને જાગૃત હરી રહ્યા છે, ત્યારે હું પામર માનની તરીકે માર્ઝ રેટિયું હું હું કથાં એ વિચાર અને કથાં હું વામત !"

સ્વરાક્યપ્રાપ્તિ પછી એમનો રાજક્ષારણથી રસ કંઈક ઓછા થયો, રચનાલેક હાંયેંબાં જીવ પરોણાયો. એવામાં સંયુક્ત મુંબંદી રાજ્યનો નિર્ધિષ્ટ લાંડેર થયો. ઈંહુલાકે અગેવાની લઈ 'મહાગુરુજ્ઞરાત' મારે લગ્ન ચલાવી. એંઝો લોકસાંગમાં પણ ચૂંટાયા. નેન્પુર(તા. અહેમદાવાદ)નો આશ્રમ એમની પ્રદેશિયું હતું.

'એખાચિનો'માં લીલાવતી સુનશીએ ઈંહુલાક માહિક વિશે લખ્યું છે કે "ઈંહુલાક એટદે ટ્રેનની ડડ્ય, ધન્હુલાઈ એટદે આગફનાં તોદ્દાન, ધન્હુલાઈ એટદે લશકરનો સિપાહી... એમનામાં આગફનાં સમાન નિરીખા છે... દેશકાર્યનું અસિધારા નત એમણે લીધું છે. હનુમાનની માફક એમના હુદમના જાગ લાગમથી દેશ થાપદ જ કોતરેલો હોય. દેશને માટે તો એમણે કીસી લીધી છે. નમી જતી પાપણોએ નિદાસુંદરીની વિનંતિઓ એમણે બધી વાર જતી હરી હોય."

"જુહન-સંભારણું"માં શારદાવાહન મહેતા ઈંહુલાક યાશિકને અંભલિ અર્પણાં લખે છે કે "આ વખતથી ધન્હુલાકે ગુરુજાતને પોતાનું સેવાકેન ગય્યું અને ત્યારી તેઓ અમારા ઘરમાં એક કુટુંબીની તરીકે આવવા જવા લાગ્યા. એમની અસર અમારા ઉપર તથા અમારા ઘરનાં છાંડરા ઉપર પણ જ થઈ. એમનામાં જુવાનીનું જેમ હતું, આદર્શ માટે જંખી રહ્યા હતો અને પોતાનું કર્તવ્ય હોમીને, સાચા કર્મયોગ થઈને રહ્યા હતા. એમણે શુભરાત્રાની જે સેવા કરી છે તે અનેહ છે, પણ ગુરુજાતે તેની કંદર હરી નહિ અને એક સાચો સેવક ગુમાયો."

તા. ૧૭ મી જુલાઈ ૧૯૭૨ ના, લગભગ ૨૨ દિવસ સુધી અમદાવાદની વાડીલાક સારાખાઈ હોસ્પિટલમાં ખૂર્ઝિત અવસ્થામાં રહી એમણે અંતિમ ધાસ લીધા. સાક્ષર ઉમાશંકાઈ જોશીએ એમને 'અસીર નગરોના ઇકોર નેતા' ગણ્યાયા હતા.

૩૪, તિરુપ્તિનિષ્ઠયમ, સ્વામિનારાયણ સેવાચારી, અદવજીનગર, કૃષ્ણ-૩૭૦૦૦૧



જ્યોરે ગુજરાતની ધરતી સોનું પૃક્વરો

સરદાર સરોવર યોજના ગુજરાત માટે કામગૈતુની કેમ હુણ્ણી
સાખિન થવાની છે.

સરદાર સરોવર યોજના અથવા ૪૩૭ વર્ષથું આયુષ, પ્રતિહિન
૩. ૪ કરોડની આપક, ૬ લાખ લોકને કાપમી રોજગાર, ૧૩૧ શહેરો
અને ૪,૭૨૦ ગામાંથેનાં ૨,૬૫,૦૦૦૦૦ લોકાની તૃપત્તિ,
૨૫,૦૦,૦૦૦ લોકને સિંચાદના લાભ, ૮ લાખ હેક્ટર જમીનને સિંચાઈ,
૪.૨૫ કરોડ વૃક્ષાનું વૃંદાવન, ૫૦૦ કરોડ યુનિટ વીજાઉત્પાદન, ઉદ્યોગાના
વીજ-કાપના અંત, માસ્કયોગથી ૩. ૧૮૫ કરોડના દ્રાયહા, હૃષ્ણેત્રે
૩. ૬૦૦ કરોડનો લાભ, ૪૫ ટકા ઐતિહાસિક વૃદ્ધિ. આરોગ્ય સુધરણે,
રણ અદૃષ્ટે અને પર્યાવરણ મધ્યવન કેનું બની જશે, નાન સરોવર બનશે
નથલું નભરાણું, હુદાર, કાળિયાર અને ધુખમલ રીછને અભયાણવન,
સૌરાષ્ટ્ર બનશે સુજલામ સુફલામ, રણ રીકાશે, પવિત્ર કિનારે પ્રવાસ-
ધામ બનશે, દુષ્કાળને ગુડ બાધ, રાજ્યનો આર્થિક વિકાસ થશે, સ્થાપિતોને
નથાળવન મળશે, ગુજરાત નંદુનવન બનશે.

સરદાર સરોવર નર્મદા નિગમ, લિ.,

ફોન નં. ૧૨, પ્રથમ ભાગ,

સરદાર ભવન,

ગાંધીનગર-૩૮૦૨૧૦



મુદ્રણ પ્રકાશન અને તત્ત્વી : 'પાઠક કાર્યાલય' માટે પ્રે. ક્રેશવરામ કા. શાખી, કે. મધુવન, એલિસાભિજ,
અમદાવાદ-૩૮૦ ૦૦૧ તા. ૧૪-૬-૧૬૬૭

મુદ્રણસ્થાન : પ્રેરણા મુદ્રણાલય, રૂસ્તમભાઈના હાલ, મિરજપુર, અમદાવાદ-૩૮૦ ૦૦૧

પૂછ : ઈ-ટરનેશનલ પ્રિન્ટિંગ વર્ક્સ, થાંપુર, માણિકાંની પોણ સામે, અમદાવાદ-૩૮૦ ૦૦૧